



સર્વાત્મનારી ભગવાન શ્રી ત્વામિનારાયણની પ્રાગટ્યભૂમિ છોયામાં પ.પુ. આચાર્ય મહારાજીના આશીર્વાદથી ઉજવાયેલ ‘શ્રી છોયાદામ મહોત્સવ’ પ્રસંગે બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજનો પંચામૃત-કેસર જળે વડે અભિપ્રેત કરતા પ.પુ. ૧૦૮ ભાવિયાચાર્ય શ્રી નગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ધર્મકુળ પરિવાર





सर्वावतारी भगवान् श्री त्यामिनारायणी प्रागट्यभूमि छपेयामां प.पू. आचार्य महाराजश्रीना आशीर्वदशी प.पू. १०८ श्री भाविआचार्य श्री नुगेन्द्रप्रसादशु महाराजश्री तथा समग्र धर्मकुङ्ल परिचयना सन्निध्यमां पू. म.गु. स्थामी श्री लक्ष्मीप्रसादासजुना मार्गदर्शन प्रमाणे उज्ज्वायेल 'श्री छपेयाधाम महोत्सव'

१. श्री प्रागट्य. २. श्री धनश्याम प्रागट्योत्सव. ३. कथा अंतर्गत जेतपुर गाहि-पृष्ठाभिपेक प्रसंगे दाकोरज्ञो अभिपेक करता पू. वील संतो. ४. कथा अंतर्गत अमरकृष्टोत्सवनी आरती उतारता पू. संतो तथा यजमानश्री. ५. रासोत्सव. ६-७. कथा सभामंडप तथा श्री नारायण सरोवरना किनारे समूह महापूजा. ८. बाणप्रभु श्री धनश्यामना अवैष्टिक बाणलीला दर्शन पुस्तकनु विमोचन करता पू. पू. लालज्ज महाराजश्री तथा संतो-भक्तो. ९. प.पू. लालज्ज महाराजश्रीनु स्वागत करता स्वयंसेवको. १०. बाणप्रभुश्रीना प्रासादिक पारशीयांना आरती उतारता भने पू. बाणलालज्जश्री. ११. बाणप्रभुश्रीना प्रासादिक पारशीयांना दर्शन करता पू.पू. लालज्ज महाराजश्री. १२. समूह आरती.




सर्वांतरी भगवान् श्री त्यामिनारायणी प्रागट्यभूमि छपेयामां पू. आचार्य महाराजश्रीना आशीर्वादथी पू. १०८ श्री लाविआचार्य श्री नुगेन्द्रमसाद्गु महाराजश्री तथा समग्र धर्मकुण परिवारना सानियमां पू. स.गु. त्यामी श्री तक्षीप्रसादासज्जुना मार्गदर्शन प्रमाणे उड़वायेव 'श्री छपेयाद्याम महोत्सव'

१. महोत्सव सभामंड़. २. पू. लालश्ल महाराजश्रीनु पुष्पमाला पहेरावी स्वागत करता महोत्सवना आयोजक पू. स.गु. स्वामी श्री लक्ष्मीप्रसादासज्ज. ३. वक्ता पू. स्वामी श्री विवेकस्वप्नपदासज्ज. ४. पू. स.गु. स्वामी श्री नित्यस्वप्नपदासज्ज - सरधार. ५. छपेया मंटिरना महंत पू. ब्रह्मवारी स्वामी श्री वासुदेवार्थांठ. ६. जूनागढ मंटिरना महंत पू. शा. स्वामी श्री भजितप्रकाशदासज्ज. ७. अमदावाह ठेशना वरिष्ठ संत पू. शा. पी.पी. स्वामी. ८. जूनागढ टेम्पल बोर्डा पूर्व चेरमेन पू. शा. स्वामी श्री प्रेमस्वप्नपदासज्ज. ९. कंकरिया मंटिरना महंत पू. स्वामी श्री गुणप्रसादासज्ज. १०. धर्मकुण पूजनना यज्ञमान न्यालकरण श्रुपना मगनभाई तथा रमेशभाई गोणवीया. ११. पू. एस.पी. स्वामी - गढा बोर्ड सलाहाकार. १२. महोत्सव मुख्य प्रज्ञमान माधिया परिवारनु सन्मान.



જૂનાગઢ પ્રદેશના નાના મુખ્યાસર ગામને આંગણે પ.પૂ. ધ.ধુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાથી પ.પૂ. લાલજી
મહારાજશ્રીના દિવ્ય સત્ત્વિધમાં ઉજવાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 'દશાંભી મહોત્સવ' તથા પૂ. સ.ગુ. સ્વામી શ્રી
નિત્યસ્વરૂપદાસજીના વક્તાપટે 'શ્રીમદ્ સત્તસંગીજીવન કથા પારાયણ' (તા. ૧૮ થી ૨૫-૧૨-૨૦૧૫)



શ્રી સ્વામિનારાયણ મંદિર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર
તા. અ. રાજકોટ - ૩૬૦૦૨૫.

શ્રી સ્વામિનારાયણ મંદિર

શ્રી સ્વામિનારાયણ મંદિર (વેદાંતાચાર્ય)

શ્રી સંકલન

સાધુ અમૃતસ્વરૂપદાસજી

ગુરુ : પૂ. સ.ગુ. શ્રી નિત્યસ્વરૂપદાસજી

શ્રી લલાભ દર

બે વર્ષ : રૂ. ૧૬૦/-, પંચાર્થિક : રૂ. ૩૫૦/-

પંચીસ વર્ષ : રૂ. ૭૫૦/-

પરદેશમાં લલાભ : \$ 200 (બુઝાએ) : £ 125 (બુઝે)

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર

Visit us : www.sardharkatha.com

www.swaminarayanvadtalgadi.org

E-mail :- chintankaryalay@gmail.com

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામુ ॥

સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરતું શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધારનું રજિસ્ટર્ડ મુખ્પત્ર ઈ.સ. ૨૦૦૫ના જૂન માસથી પ્રારંભાયેલું, દર માસની ૨૦ તારીખે પ્રકાશિત થતું, આપના સમગ્ર કુટુંબ-પટિવારમાં આનંદ અને સંરક્ષણની સૌરભ પ્રસરાવે અને જીવનનું અનેરં ઘડતર કરતું સામયિક.

સ્વામિનારાયણ ચિંતન

વર્ષ : ૩, અંક : ૧૨, તા. ૨૦-૦૧-૧૬

પ્રયોજક : પૂ. સ.ગુ. શ્રી નિત્યસ્વરૂપદાસજી

અનુક્રમિકા

“ભાવનગરની ધરતીમાં એવું કંઈક પડ્યું છે કે લોકો ઈચ્છે કે ન ઈચ્છે, અમલદારો ઈચ્છે કે ન ઈચ્છે, પણ માણસાઈ પોતાનો માર્ગ કરે છે અને માણસાઈનો આવો કોઈક અંશ ભાવનગરની પ્રજાને ટકાવી રાખે છે. ભાવનગરની અને કાઠિયાવાડની માણસાઈને કોણે પોથી છે તેનો વિચાર કરવો ધટે.” - શ્રી નાનાભાઈ ભક્તિભિત્તિપુસ્તક ‘ધનરાનને ચડતર’માંથી...

ગોહિલવંશના સેજકજીથી આરંભીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી સુધીના ૭૦૦ વર્ષોમાં ૨૬ રાજવીઓ થઈ ગયા. તેમાંથી કોઈ એક પણ પ્રજાપીડક ન હતા. તેઓ સૌ એક-એકથી ચઢિયાતા પ્રજાવત્સલતાના ઉદાહરણો મૂક્તા ગયા છે. ભાવનગર રાજ્ય આર્થિક રીતે સમૃદ્ધ થતું ગયું, રાજવીઓના મોજશોખ મયર્યાહિત થતા ગયા અને તેના સહજ પરિણામરૂપે કલાપ્રેમ તેમજ પ્રજાવિકાસ માટે માર્ગ મોકાણો થતો ગયો. આથી ગોહિલ રાજવીઓએ પ્રજાવત્સલતા અને સમૃદ્ધ વિકાસના એક-એકથી ચઢિયાતાં સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે.

- શ્રી ગંભીરસિંહજી ગોહિલ લેખિત પુસ્તક ‘પ્રજાવત્સલ રાજવી’માંથી...

અનુક્રમિકા

૧. ભાવનગરથી મહાભારતનો ગ્રંથ લાવતા ખુશાલ ભણ ૦૬

૨. ભાવનગરમાં લાડુદાનરૂપે પદ્ધારેલ સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી ૦૮

૩. ભાવનગરના પરમ ભક્તતરાજ ધૈર્યવાન શ્રી રૂપાભાઈ ૧૪

૪. પ્રજાવત્સલ-ન્યાયપ્રિય મહારાજા રાખોલ શ્રી કૃષ્ણકુમારસિંહજી ૧૮

૫. સત્તંગ સમાચાર પત્રિકા ૨૧



Online : www.lakshyatv.com

પ્રે. ૧૦૮ શ્રી વિવિનાયાર્ય
શ્રી રૂપેન્દ્રસાહિની
દિવ્યાઅમૃતલાયાણી

સમય : દરરોજ

સમય : દરરોજ રાતે ૮.૦૦ બી ૧૧.૦૦

પ્રે. સ.ગુ. શ્રી નિત્યસ્વરૂપદાસજી
સંસ્કૃત
કથા પારાયણ

સમય : દરરોજ રાતે ૮.૦૦ બી ૧૧.૦૦


સમય : દરરોજ રાતે ૮.૦૦ બી ૧૧.૦૦

પ્રે. સ.ગુ. શ્રી પૂર્ણલેખપદસંકાળ શ્રીમુખે
સંસ્કૃત
કથા લુદ્દાયણ

સમય : દરરોજ રાતે ૮.૦૦ બી ૧૧.૦૦

સમય : દરરોજ રાતે ૮.૦૦ બી ૧૧.૦૦

છનીકાલ : શિવલાલ સુદારાઈ - બારમક્ષ, મો. ૮૮૭૭૨૬૮૫૪૦



ભાવનગરથી મહાભારતનો ગ્રંથ લાવતા ખુશાલ ભડુ

(સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી)

સાધુ અમૃતસ્વરૂપદાસજી શુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

સં. ૧૮૬ ઉમાં કોઈ અગત્યનો પ્રસંગ ખુશાલ ભડુ વિષે પણ તે ગ્રંથ આપ્યો નહોતો.

નોંધાયેલો હોય તો તે ભાવનગરથી મહાભારત ગ્રંથની પ્રાક્તિકાનો છે. આ પ્રસંગ ખુશાલ ભડુને દીક્ષા આપી તે પહેલાનો છે.

સં. ૧૮૬ ઉમાં ભણનારા સંતો માટે શ્રીજમહારાજને મહાભારતના ગ્રંથની જરૂર પડી. તે વખતે મુદ્રણ કળાના અભાવે ગ્રંથોની હસ્તકિબિંદિ પ્રતો લહીઆઓ તેથાર કરતા. આવા ગ્રંથો ભારે કિંમત આપતાંય મળી શકતા નહિ. તે વખતે ગુજરાત કાઠીયાવાડમાં મહાભારતની ગડીગાંઠી પ્રતો હતી. આવી એક પ્રત ભાવનગરમાં કાશીરામ નામના એક વિગ્રહે ત્યાં હતી. ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણ પ્રાગાજ્ઞ દવે અને લખીરામ દેરાસરીને તે ગ્રંથ લેવા ભાવનગર મોકલ્યા હતા,

ભગવાન શ્રીહરિ ગઢપુરમાં વાસુદેવનારાયણના ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા બિછાવીને તે ઉપર ઉગમણે મુખારવિંટે બિરાજમાન થઈને મહારાજ હરિભક્તો અને સંતોની સભામાં ધર્મોપદેશ કરતા હતા. તેવામાં વડોદરાથી વિદ્યા ભણીને ખુશાલ ભડુ આવ્યા. મહારાજે તેમને પૂછ્યું : “વડોદરામાં સૌ હરિભક્ત કુશણ છે ? વૈઘરાજ રામચંદ્ર કુશણ છે ?” ત્યારે ખુશાલ ભડુ કહ્યું : “મહારાજ ! સર્વે કુશણ છે અને સર્વએ આપને દંડવત પ્રણામ કર્યા છે.” વળી મહારાજે પૂછ્યું : “તમે બધી વિદ્યા ભણી લીધી ?” “હા, મહારાજ ! આપના પ્રતાપથી વિદ્યા ભણી આવ્યો છું.” પછી શ્રીજમહારાજે પરીક્ષા સારુ કેટલાક પ્રશ્નનો પૂછ્યા.

તेना ઉત્તર ખુશાલભટે તરત આપ્યા. પછી વેદની કંઈ અને શુનિઓ બોલવાનું મહારાજે કહ્યું. તે પણ બોલી બતાવી. તે સાંભળી ભગવાન શ્રીહરિ બહુ રાજ થયા અને પોતે ઉભા થઈ બાથમાં ધાલીને ખુશાલ ભડને મળ્યા અને કહ્યું : “અમારે મહાભારતનું પુસ્તક જોઈએ છીએ તે ભાવનગર છે. તે લેવા સારું બે-ત્રાણવાર પ્રાગળું દરે અને લખીરામ દેરાસરીને મોકલ્યા હતા, પણ કાશીરામ વિપ્રે તે ગ્રંથ આપ્યો નહિ. તો તે તમો જઈને તે લઈ આવો.”

મહાભારત ગ્રંથ લઈ આવવાની શ્રીજમહારાજે આજા કરી. તેથી ખુશાલ ભડે ભાવનગર જવા તૈયાર થયા. ખુશાલ ભડની સાથે જવા માટે લખીરામ દેરાસરીને પણ તૈયાર કર્યા. તે ચાલતાં ચાલતાં રેવા ગામમાં બજારમાં ચાલ્યા જતા હતા. તે વખતે એક શેઠ પોતાના ઘેર મેરીએ બેઠા હતા. તેમણે ખુશાલ ભડના શરીરમાંથી તેજ નીકળતું જોયું. તેથી તે વાણિયા શેઠ ખુશાલ ભડને બોલાવી પોતાને ઘેર ઉતારો કરાવ્યો. પછી ખુશાલ ભડે વાતો કરવા માંડી અને શેઠને સમાધિ થઈ. એટલે ઘરના સૌ માણસો ભય પામ્યા કે શેઠને અચાનક આ શું થઈ ગયું ? પછી શેઠ સમાધિમાંથી જગ્યા અને ખુશાલ ભડને પૂછ્યું : “આપ કંઈ જમશો ?” ત્યારે ખુશાલ ભડે કહ્યું : “અમારે જમવું નથી. આ બ્રાહ્મજાને રસોઈ કરાવીને જમાડો.” પછી લખીરામને સીધું આપ્યું તેથી તેણે રસોઈ કરી પોતે જમ્યા.

પછી લખીરામ દેરાસરીએ ખુશાલ ભડને કહ્યું : “જેવો વાણિયાને તમે ચમલકાર બતાવ્યો તેવો ચમત્કાર કાશીરામ વિપ્રને બતાવશો તો મહાભારત ગ્રંથ આપશો.”

આ રીતે બંને વાતો કરતા ભાવનગર ગયા અને શ્રીએણાભાઈ શ્રીમાણીને ત્યાં ઉત્તર્યા. બીજે દિવસે બ્રાહ્મજાને ઘેર ગયા ત્યારે તે બ્રાહ્મજા બાલકૃષ્ણની પૂજા કરતો હતો, તેથી ખુશાલ ભડને આવકાર ન દીધો. પરંતુ તિરસ્કારના બે શબ્દો કહ્યા. તો પણ ખુશાલ ભડે તો તેની સામા કેવળ પૃથ્વી ઉપર બેસી ગયા. તેવામાં બાલકૃષ્ણની પ્રતિમા ફરીને ખુશાલ ભડની સન્મુખ થઈ ગઈ. ત્યારે તે વિપ્રે મનમાં કંઈપણ ખ્યાલ નહિ લાવતાં તે પ્રતિમાને પાછી પોતાની સન્મુખ પધરાવી. પરંતુ તુર્તજ તે પ્રતિમા પાછી ફરીને ખુશાલ ભડે સન્મુખ થઈ ગઈ. ત્યારે તે વિપ્રે મનમાં કંઈપણ ખ્યાલ નહિ લાવતાં તે પ્રતિમાને પાછી પોતાની સન્મુખ પધરાવી. એપ્રમાણે બે-ત્રાણ વાર થયું ત્યારે ખુશાલ ભડે ‘અતિથિ ગૃહસંપ્રાપ્તા

પૂજયેત્વાગતાદિના । અર્ધાસન-પ્રદાનેન પાદપ્રક્ષાલનેન ચ ॥૧॥ શ્રદ્ધયા ચાન્દાનેન પ્રિયપ્રશ્નોત્તરેણ ચ । ગચ્છન્તન ચાનુયાનેન પ્રીતિમુત્યાદયેદગૃહી ॥૨॥’ આ શ્લોક સંભળાવીને કહ્યું : “તમે ઘેર આવેલા અતિથિનું સંભાન ન કર્યું તેથી ભગવાન તમારી સાથે રીસાય છે.”

તે સાંભળી વિપ્ર વધુ કોષિત થઈને ધમકી દઈ બોલ્યો : “તમો અહીંથી ચાલ્યા જાઓ, હું મહાભારતનો ગ્રંથ આપવાનો નથી.” પછી ખુશાલ ભડે અને લખીરામ દેરાસરી તાંથી નીકળીને જીણાભાઈ શ્રીમાણીને ત્યાં આવ્યા.

તે જ રાત્રિએ કાશીરામ વિપ્ર સૂતો હતો ત્યારે યમદૂતોએ આવી તેને ખૂબ માર માર્યો. ત્યારે તે બ્રાહ્મજા જીમીન રાખીને ગ્રંથ આપવા કબૂલ થયો. અને તે ગ્રંથના બદલામાં ૩૦૦ રૂપિયાનું ઘરેણું ગીરો મૂકવાનું કહ્યું. પછી જીણાભાઈ શ્રીમાણીની પત્નીનું ૩૦૦ રૂપિયાનું ઘરેણું કાશીરામ વિપ્રને આપ્યું અને એક માસમાં મહાભારત ગ્રંથ પાછો આપવાની શરત કરી.

પછી તે મહાભારત ગ્રંથને પોછિયો કરીને ખુશાલ ભડે ગટપુર લાવ્યા. શ્રીજમહારાજને સભામાં તે ગ્રંથ અર્પણ કર્યો. તે વખતે ભગવાન શ્રીહરિએ પીણું શેલું ઓઢાયું હતું તે ખુશાલ ભડને ઓઢાડ્યું. ત્યારે ખુશાલ ભડે કહ્યું : “મહારાજ ! આ તો લખીરામનો દાખડો છે. અને તેણે ખૂબ ગાળો ખાધી છે. માટે તેને આ શેલું આપો.” એમ કહી ખુશાલ ભડે તે શેલું લખીરામને ઓઢાડ્યું. ત્યારબાદ શ્રીજમહારાજે સહુ લહિયા સંતોને બોલાવીને મહાભારત ગ્રંથ આપ્યો. અને તે એક માસ પહેલા આખો ગ્રંથ શુદ્ધ રીતે લખાવીને તપાસી અસલ ગ્રંથ ભાવનગર પાછો મોકલી દીધો. આ રીતે ખુશાલ ભડે ભાવનગરમાં કાશીરામ વિપ્રને ચમત્કાર બતાવી મહત્વનું કાર્ય કર્યું હતું.

આ મહાભારતના ગ્રંથની પ્રત હાલ ગટડામાં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરની પાછળ આવેલ આનંદભૂવનમાં રાખવામાં આવી છે. તે પ્રતને ત્યાં એક મોટા પોટલામાં ધોળા કપડાથી બાંધીને બીજી પ્રસાદીની વસ્તુઓ સાથે કબાટમાં રાખેલી છે. તે પ્રત દોઢ ફૂટ લાંબી અને એક ફૂટ જેટલી પહોળી અને એક ફૂટ ઊંચી છે.



ભાવનગરમાં લાડુદાનરૂપે પદારેલ સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી

ભગવાન શ્રી સ્વામિનારાયણનો ગ્રોટ પ્રતાપ જણાવવા માંચ્યો હતો. પરીક્ષા કરવા, ચિકિત્સા કરવા કે બીજી જે કોઈ ભાવથી શ્રીજમહારાજના દર્શને જે આવતા તેમને અવનવા

અનુભવો થતા. કોઈકને સમાધિ થઈ જતી અને સમાધિમાં તેમના ઈષ્ટદેવનાં, તે દેવના ધામના તેમને દર્શન થતાં. તે સ્વરૂપો ભગવાન શ્રીહરિના સ્વરૂપમાંથી પ્રગટાં અને પાછા શ્રીહરિના સ્વરૂપમાં લીન થઈ જતાં. આથી ભાવિકોને નિશ્ચય થતો કે સ્વામિનારાયણ સાક્ષાત્ ભગવાન છે. કોઈકને તેમના સંકલ્પોના ઉત્તર મળી જતા, તો કોઈકના સંકલ્પો ફળતા. મહાપ્રભુ શ્રીહરિનો આવો અદ્ભુત એશ્વર્-પ્રતાપ જોવા થતાં જેને આ કૃપાસમાદિનો પોતાની બુદ્ધિને સંતોષ થાય એવો ઉકેલ ન મળતો ત્યારે તે માનતા કે ભગવાન શ્રીહરિએ બાબરો ભૂત વશ કર્યો છે, કાં તો કોઈક મંત્રનો ગુટકો તેમની પાસે છે તેથી તેમના દર્શન કરવા આવનારને અણાંગ યોગની સાધના કર્યા વગર સમાધિ થાય છે.

આ રીતે કેટલાક મુમુક્ષુઓ શ્રીજમહારાજનો પ્રતાપ જોઈ તેઓના શરણે થઈ જતા, જ્યારે કેટલાક આ ધર્તિંગ છે એવું કહી ભગવાન શ્રીહરિની પ્રવૃત્તિને ડામવા માટે ઊઠાપોઈ કરતા.

કાઠિયાવાડનો કાઠી સમાજ ધીરે ધીરે ભગવાન શ્રી સ્વામિનારાયણના અદ્ભુત પ્રતાપથી આકર્ષાઈ મહારાજના શરણે થવા લાગ્યો હતો.

આ વાત ઠેઠ ભાવનગર સુધી પહોંચી. ભાવનગરના મહારાજા ઠાકોર વખતસિંહજી¹ ગોહિલકુળદીપક, પ્રજાવત્સલ હતા. શત્રુને પણ સન્માનવાની, બિરદાવવાની તેમનામાં ખાનદાનીહતી. વળી, સાહિત્ય અને કળાના પોષક હતા. પ્રજાની આબાદીમાં પોતે સુખ માણતા. પરંતુ પ્રજામાં પ્રચાર પામતાં કુલકણો કે અસદ્દ વર્તનને પોતે સહન કરી શકતા નહિ.

તેમને સમાચાર મળ્યા કે, ‘આપણા રાજ્યના ગઢડામાં ઉત્તર હિંદુસ્તાનમાંથી એક એકવીસ-બાવીસ વર્ષનો બાવો આવ્યો છે. બાપુ અભલભાયરના દરબારમાં પડ્યો પાથર્યો રહે છે. તેના દર્શને જે જાય તેને તે સમાધિ કરાવે છે અને પોતે ભગવાન થઈ પૂજાય છે. બાપુ અભલભાયર તથા બાપુ જીવાભાયર તેના શિષ્ય થઈ ગયા છે. આ ધર્તિંગને વહેલી તકે ડામવાની જરૂર છે.’

ઠાકોર વખતસિંહજી બાપુને રોજના રોજ આવા વાડ મળ્યે જતા હતા. તેથી તેમને પણ ભ્રમ પેઠો. કળિયુગમાં ભગવાન ક્યાંથી હોય? યુગે યુગે ભગવાન અધર્મનો નાશ કરવા અને

ધર્મનું સંસ્થાપન કરવા પ્રગત થાય છે એ ઓસાણ તેમને રહ્યું નહિ. તેમને લાગવા માંડ્યું કે આ પાપને વહેલી તક પ્રગત કરી દેવું જોઈએ.

એટલામાં તેમને સમાચાર મળ્યા કે જૂનાગઢના નવાબ મોહમ્મદ હામીદખાન (પહેલા) પાસેથી અનેક શિરપાવ લઈ ખાણ ગામના કવિ લાડુદાનજી ભાવનગર પથારે છે. તેમને પોતાના કવિતથી વખતસિંહજી બાપુને રિજાવવા છે વખતસિંહજી બાપુ આ સમાચાર સાંભળી રાણ થયા. કવિશ્રી મારે ઉત્તમ પ્રકારનો રજવાડી ઉતારો, ખાનપાન તથા યોગ્ય સરભરાની તૈયારી કરવા તેમણે હુકમો આપી દીધા.

કવિશ્રી લાડુદાનજી ભાવનગરમાં પથાર્યા. મહારાજાના હુકમ અનુસાર તેમનું ઉત્તમ સ્વાગત કર્યું, ઉતારો કરવાયો. તેમની તમામ પ્રકારની ભરદાસ્ત કરવામાં રાજ્યના અનુચરોએ કંઈ ખાખી રાખી નહિ. પછી વખતસિંહજી બાપુને તે સમાચાર મોકલાવ્યા. બાપુએ તરત જ કહેવરાયું કે, ‘કવિને લાંબા પથનો થાક હશે, માટે થોડા દિવસ રહી થાક ઉતારે. પછી મુલાકાત ગોઠવીશું.’

આ સમાચાર કવિશ્રી લાડુદાનજીને આપ્યા. પરંતુ તેમને જનમભૂમિમાં જવાની ઉતાવળ હતી. તેથી વખતસિંહ બાપુને જેમ બને તેમ જલદી મળવાની તેમની ઈચ્છા હતી. તેમની આ ઈચ્છાને માન આપી બાપુએ તે પ્રમાણે સભા ગોઠવવાનો હુકમ આપી દીધો.

ભાવેષા દરબાર વખતસિંહ બાપુએ કવિશ્રી લાડુદાનજીની વિદ્ધતા અને પ્રતિષ્ઠાને છાજે તેવું સંનામ દરબારમાં કરવાનો નિર્ણય કરી લીધો. રાજ્યસભામાં પોતાના રાજ્યના વિદ્ધાનો આમંત્રયા, રાજ્યવીઓને તો આગણી આમંત્રણ આપી બાપુએ સૌને બોલાવી લીધા હતા. સૌને કહેણ મોકલી દીધું કે, ‘કવિશ્રી લાડુદાનજીના સંનામની સભા આજે યોજ્ય છે.’

કવિશ્રીની વિદ્ધતાને બિરદાવવાનો, તેમને સાંભળવાનો આ અનુપમ લ્લાવો લેવા ભાવનગર દરબારની કચેરી હક્કેઠં એ મહાવીર મોખડાણના જ વંશમાં આપ એ બિકુદ સાચવી

1. ડાકોર વખતસિંહજી બાપુ ઈ.સ. ૧૭૭૨માં ગાદી ઉપર આવ્યા અને ઈ.સ. ૧૮૧૬ સુધી નેઓએ રાજ્ય કર્યું. કવિરાજ લાડુદાનજી ભાવનગરમાં આવ્યા તે સમય ઈ.સ. ૧૮૦૫ (સં. ૧૮૬૧) હતો. તેથી વખતસિંહ બાપુએ જ સંનામન્યા છે તે નક્કી છે. અને ડાકોર વજેસિંહ બાપુ ઈ.સ. ૧૮૧૬ થી ઈ.સ. ૧૮૨૨ (સં. ૧૮૭૦) સુધી ગાદી ઉપર હતા. તેથી કવિરાજ લાડુદાનજીને તેમણે સંનામન્યા હોય એ શક્ય નથી, પરંતુ વજેસિંહ બાપુની ‘ધૂવરાજ’ તરીકે હાજરી હોય તે શક્ય છે.

2. જેમ વસંતપંચમી પાનખરણી ઉગારી નૂતન વસંતત્રણતુનું પ્રદાન કરી સમગ્ર પ્રકૃતિને નવપદ્ધિવિત કરે છે, તેમજ નિસ્તેજ બનેલા કાવ્ય-કવિત્વને ઉગારી લઈ અદ્ભુત ને અજોડ કાવ્ય ને કવિત્વની સુંદર રચનાઓનો કરી સમગ્ર વિદ્યાને કવિત્વનો એક નવોજ રાંદ દેખિગોયેર કરવા માર્ગન્યાં ગુજરાત-રાજ્યસભાની સરહદના સીમાડે આવેલ મારવાડ પ્રદેશના કુંગારા તાલુકાના ખાણ ગામે મારુ ચારણ કુણાના આશીયા શાખાના ગઢવી શંભુદાનજી અને મહા પતિત્રા લાલુબા ટેવીની કુમે ‘જેમ છીપમાં નવલધું મોતી જન્મે તેની કર્દી નવાઈ ન હોય’ તેમ તેવા ખાનદાન દ્વારા જન્મ થયો હતો. સં. ૧૮૨૮ના વસંતપંચમી (મહા સુદ-૫, તા. ૮-૨-૧૭૭૨)ના રોજ લાડુદાન ગટવીનો જન્મ થયો હતો.

‘પુત્રના લક્ષ્ણ પારણામાંથી જણાય’ તે ન્યાયે બાળપણથી જ લાડુદાનના મુખેથી કાવ્યો ગવાયા કરતા. પિંગળ શાખનો ધમડકાન્યુજ આદિક ગામોમાં અભ્યાસ કરી ‘રાજકવિ, રાજરન, પિંગળ વિદ્ધાયાર્ય, સહભાવધાન, શનાવધાન, શીધ કવીશ્વર’ વગેરે જિતાલોનો યથ પ્રામ કર્યો હતો.

ભરાઈ ગઈ. કવિ લાડુદાનજીને તેડવા ખાસ હજૂરી અને સેવકો સાથે પાલખી મોકલી હતી. અન્ય રાજ્યવીઓ, કવિઓ અને વિદ્ધાનો સભામાં ગોઠવાઈ ગયા હતા. બાપુ વખતસિંહજી મખમલના ગાદી-તકિયા ઉપર બિરાજમાન થયા હતા.

એટલામાં ચોપદારે નેતીનો અવાજ પુકાર્યો. વખતસિંહજી બાપુ કવિશ્રીની તાજુમ સ્વીકારવા પોતે જાને ઊભા થઈ સામા ચાલ્યા. ગોહિલકુલ શિરોમણિ અને ચારણકવિ શિરોમણિનું અદ્ભુત મિલન થયું, બંને ભેટટા. કવિ લાડુદાનજીને બાપુને સૂર્યવંશી કહીને બિરદાવ્યા. બાપુએ તેમને પોતાની બાજુમાં જ મખમલના ગાદી-તકિયા ઉપર બેસાર્યા.

પછી વખતસિંહજી બાપુએ કવિ લાડુદાનજીને કહ્યું : “કવિરાજ ! અમારા ગોહિલકુણને તૌ સૌ કવિઓ ચંદ્રવંશી કહીને બિરદાવે છે અને તેમે સૂર્યવંશી કેમ કહ્યા ?”

કવિએ તરત જ ખુલાસો કરતા કહ્યું : “ક્ષત્રિયમુગટમણિ, હિન્દવા શાલિગ્રામ, પ્રતાસ્મિસિંહજીની બિરદાવલીમાં ‘ગહલોત-ગહલોત’ વગેરે શદ્વમયોગ ઘણા જ પ્રાચીનકાળથી કાવ્યમાં છે. તેથી ગહલોત શબ્દનો કાવ્યમાં પ્રયોગ કરી ‘સૂર્યવંશી’ કહીને બિરદાવ્યા છે.” તે ઉપર પોતે પ્રાચીન દોહો બોલ્યા : ‘ગોહિલકુણ તન ગાટ, લેવાણ અકબર લાલચી; કોડી દે નહિ કાટ, પણ દંટ રાણા પ્રતાપાનું ગોહિલ રજ્પુતનું મજબુત કુણરૂપી ધન લૂંટી લેવાને અકબર લાલચુ થઈ રહ્યો છે. પરંતુ રાણા પ્રતાપનું ‘પણ’ (ટેક) એવું તો દંટ છે કે તે ધનમાંથી એક કોડી પણ કાઢીને તે આપતો નથી. એટલે કે પોતાના ગોહિલ ક્ષત્રિયકુણને એબલ બગાડતો નથી.

“પ્રાચીન કાવ્યોનો પ્રમાણવી જ ગોહિલ શાખામાં મહારાજા પ્રતાપનો જન્મ હતો. તે જ શાખામાંથી ધૂટા પડીને સેજકજી ગોહિલ સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. તે પછી મોખડાજી ગોહિલે પેરમ બેટ કબજે કરી પેરમના પાદશાહનું બિરુદ્ધ મેળવેલ હતું.

એ મહાવીર મોખડાજીના જ વંશમાં આપ એ બિકુદ સાચવી

રહ્યા છો.”

વખતસિંહજી બાપુ આ બિરદાવલી સાંભળી અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમને ગૌરવ થયું કે, ‘મહારાણા પ્રતાપના ગોહિલકુળમાં તેમનો જન્મ છે અને એ કુણને આજે તેઓ શોભાવી રહ્યા છે.’

કવિ લાડુદાનજીએ દોહા, છંદ અને કવિતાની રમણી બોલાવી. કાવ્યરસક્ષ મહારાજા વખતસિંહજી અતિ પ્રસન્ન થયા. ઊભા થઈ કવિશ્રીને બાથમાં લઈ બેટ્યા. કવિવરને નવાજવા સભામાં બેઠેલા રાજુલાના રાજસોની નાગદાનને બોલાવી કવિશ્રીને આભૂષણોથી ભૂષિત કરવા આજ્ઞા કરી.

રાજ-સોની મૂળ રાજુલાના, પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત. સોનીના કપાળમાં કેસરિયું તિલક અને એના મધ્યમાં ગોળ ચાંદલો જોઈ ટીખળવૃત્તિથી લાડુદાનજીએ પૂછ્યું: “મહાજન ! બેસ ભડકાવે તેવું આ તિલક કયા પંથનું છે ?”

આ કટાક્ષનો ઉત્તર સોની મહાજન આપે તે પહેલાં જ મહારાજાએ કહ્યું: “કવિરાજ ! મારા રાજ્યમાં ગઢું ગામ છે. ત્યાં હમણાં જીવનમુક્તા કરીને ઓળખાતા મહાપુરુષ આવ્યા છે. જાલાવાડ, કાઠિયાવાડ, સોરઠ, ગોહિલવાડની ભોળી પ્રજા તેને ભગવાન સ્વામિનારાયણના નામથી ઓળખે છે. તો બીજા લોકો કહે છે : ‘એશે બાબરો ભૂત વશ કર્યો છે. તેથી જો તેનું પારખું કરી આપો તો વાત થાણે પડે.’”

જોબનથી થનગન થતાં કવિએ કહ્યું : “બાપુ ! આપની ઈચ્છા છે તો જરૂર ગઢે જઈને સ્વામિનારાયણનાં પારખાં કરીશ. અભધરી જ ઊપરું, હવે એમાં વિલંબ ન હોય. આમાં તો હજારોનો કચ્ચરધાણ નીકળી જય.”

પણ વખતસિંહજી બાપુને કવિશ્રીને વધુ રોકી તેમના કવિતની લાલાણ લેવી હતી. તેથી તેમણે કહ્યું : “કવિરાજ ! એવડી ઉત્તાપણ કરવાની જરૂર નથી. થોડા દિવસ અમારી મહેમાનગતિ ચાખો, તમારા કવિતનો લાભ આપો. પછી ગઢે સિધાવજો.”

“ના, મહારાજ ! એમાં વિલંબ ન હોય. ભગવાનની ગાદીએ ચેદેલાને તો પાડવો જ પડે. ત્રણ દિવસમાં તેમનું પોકળ ઉઘાડીને આપની સામે ખડો કરીએટું.”

વખતસિંહજી બાપુને પણ લાગ્યું કે ભલે કવિરાજ જઈ આવે. કવિશ્રીએ તે દિવસે જ જવાનું નક્કી કરી લીધું. સભા બરખાસ્ત થઈ.

એટલામાં કવિ લાડુદાનજીના મામા પણ ખાણ ગમથી

તેમને તેડવા માટે શોધતાં શોધતાં ત્યાં આવી પહોંચ્યા. તેઓ લાડુદાનજીને મળ્યા. ખૂબ આનંદ થયો. પછી સાથે જમીને કવિ લાડુદાનજીએ મામાને ગઢા જવાની બધી વાત કરતા કહ્યું : “મામા ! સ્વામિનારાયણ નામે ભગવાન ત્યાં પ્રગટ્યા છે તેને ઉઘાડા પાડવા છે એટલે આજે ગઢા જવું છે. તમો પણ સાથે આવો. બેટિવસમાં તો આપણે અહીં પાછા આવી જશું.”

મામાને પોરસ ચડી ગયો. તેમણે કહ્યું : “શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડે તેમને ખાસ તેડાવ્યા છે. માટે હવે જાઝો વિલંબ નથી કરવો. સ્વામિનારાયણની પોલ બહાર પાડી એક વધુ દિન્બિજ્ય કરી આપણે વડોદરા જવાનું છે. વડોદરા તેમને માનપાનથી પહોંચાડવાનો હુકમ પણ સરકારે તેમના સૂબાને આપી રિધો છે.”

કવિરાજ લાડુદાનજી તરત જ તેયાર થયા. નીચે આવી ઘોડાની સરક હાથમાં પકડી ત્યાં નાગદાન સોનીની આવ્યા. તેમણે કવિશ્રીને નમસ્કાર કર્યા. ત્યારે કવિ લાડુદાનજીએ પૂછ્યું : “મહાજન ! કાઈ માપબાપ લેવાનું બાકી રહી ગયું છે ?”

સોની મહાજને હાથ જોડી કહ્યું : “ના, કવિરાજ ! આમ તો બધુંય લઈ લીધું છે. પણ ગઢે આપ પદારો છો ત્યાં આપનું માપ નીકળી ન જાય તે સંભાળજો.”

કવિશ્રીને આંદું કહેનાર હજુ સુધી કોઈ મળ્યું ન હતું.

ધાંગદ્રા નરેશ મહારાજા શ્રી રણમલજી, જામનગરના રાજીવી જસા જામ તથા જૂનાગઢના નવાખ મોહમ્મદ હામીદભાન (પહેલા) - આ ત્રણોય અગ્રગણ્ય રાજીવીના સન્માનનો મોરો મેળવીને હું આવું છું, ત્યારે આ ત્રણ બદામનો સોની સ્વામિનારાયણ આગળ મારું માપ નીકળી જશે એવું કહેવાની હિંમત કરે છે ! તેમણે તરત જ ભવાં ચંડાવીને કહ્યું : “મહાજન ! કાઈક બોલવામાં વિવેક રાખો. ધરેણાં ટીપી ખાનારા તમે આ કવિને શું સમજો છો ?”

નાગદાન સોની એવી જ સ્થિતપ્રણાલીથી અને આખ્ય અદ્ભુત સાથે બોલી ઉઠાયા : “કવિરાજ ! હું એટલું જ કહું છું કે આજ મીઠાની ભરેલી કોણી ખારા સમુદ્રનો તાગ લેવા જય તો પાણી આવે ખરી ? વધુ શું કહું ? આપ તો મહા વિદ્વાન કવિરાજ છો. પદારો, એ સાક્ષાત્ પ્રભુનો અવતાર છે માટે ઓળખજો, સમાગમ કરજો અને પછી મને યાદ કરજો કે આ સોની શું કહેતો હતો.”

આ સાંભળી કવિશ્રીનો પારો એકદમ ચડી ગયો. તેમણે તરત જ કહ્યું : “એ તો તમારા સ્વામિનારાયણ ભગવાનને હું આંહી લઈ આવીશ ત્યારે જોજો.! ” એટલું કહીને કવિરાજ ઘોડી

ઉપર ચડી ગયા અને ઘોડીના પેટમાં પેગડું માર્યું અને ઘોડી જાડ થઈ. થોડીવારમાં કવિરાજ અને તેમના મામા સાથીઓ સાથે ઉડતી રજમાં અદશ્ય થઈ ગયા!

ગઢપુર જેમ નજીક આવતું ગયું તેમ કવિરાજના મનમાં વિચારો ઘોળાવા લાગ્યા. ખરેખર ભગવાન હશે તો? કયે લક્ષ્ણે તેમને ઓળખવા? બહુ દા'ડા ભેગા રહ્યા તોય અર્જુનને ઓળખવા નહિ, જ્યારે મારે તો ત્રીજે દિવસે તેમને મા'ત કરીને ભાવનગર પાછા પહોંચવું છે. કવિ ખરેખર મૂંજાવા લાગ્યા. તેમની કવિત્વશક્તિ, વિદ્વતાનું અહીં, પ્રતિષ્ઠાનો ગર્વ બધું જ જ્ઞાનો અંતરમાંથી સરી જતું હોય એમ લાગ્યું. ભગવાનને ઓળખવા માટેની તેમની પાસે બુદ્ધિ નથી, શક્તિ નથી. અંતરમાં ભગવાનને મા'ત કરવાના તેમના સંકલ્પો હતા તે ટળી અને હવે તેમને ઓળખવાના સંકલ્પો થવા લાગ્યા.

અચાનક તેમના હૃદયમાં શાંતિનો ચમકારો થયો. તેમણે પરીક્ષા કરવા ભગવાન શ્રી સ્વામિનારાયણને પારખવા માટે ચાર સંકલ્પોનકી કર્યા:

(૧) જો તે ભગવાન હશે તો અંતર્યામીપણે ત્રિકાળદર્શી હોળાથી મારું સમગ્ર જીવન વૃત્તાંત મને વગર કરો કહી સંભળાવશો.

(૨) ભગવાનની ઓળખાડા માટે સામુદ્રિક શાખમાં ૧૬ ચિહ્નો જણાયાં છે તે મને પૂછ્યા વિના બતાવે.

(૩) હું તેમને મળવા જાઉં ત્યારે તેમના કંઠમાં ગુલાબનો હાર (ચાલુ મોસમમાં અસંભવિત હોવા છતાં) પહેર્યો હોય અને તે હાર મને પ્રથમના મેળાપમાં મારા નામથી પહેરાવી સ્વાગત કરે.

(૪) હું ત્યાં જાઉં ત્યારે કાળા કામળા ઉપર શ્રીમદ્ ભાગવતનું પુસ્તક રાખી પૂર્વ મુખે બેસી કથા સંભળાવતા હોય...

આ પ્રમાણે ચાર સંકલ્પો કરતા હતા એટલામાં ગઢપુર આવી ગયું. લાડુદાનજીએ એભલખાચરના દરબારગઢમાં પ્રવેશ કર્યો.

આ સમયે શ્રીજમહારાજ પોતાની આગળ સંતો-હરિભક્તોની સભા ભરીને લીબવુક્ષ નીચે રંગતપાટ ઉપર પૂર્વમુખે સર્વ શેત વખ્તો પહેરીને વિરાજમાન હતા. ભગવાન શ્રીહરિની પાછળ શખધારી પાખદો ભગુજી, રતનજી, જાલમસિંહ, બેચર ચાવડા વગેરે ઊભા હતા. મહાપ્રભુ શ્રીહરિની સન્મુખ મુક્તાનંદ સ્વામી આદિક સંતો બેઠા હતા. હરિભક્તો પણ હતા. બાપુ એભલખાચર પોતાના કુમાર

દાદાભાચરને ઘોળામાં લઈને બેઠા હતા. સીઓ દૂર મહારાજની આજ્ઞાપ્રમાણે મર્યાદા સાચ્યવી બેઠી હતી. ચારે બાજુ ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પદ્ધતિમ કોરના ઓરડાની લાંબી પડ્યારમાં પણ ક્રીઓ બેઠી હતી. સફેદ માટીથી લીંપીને આરસ જેવી મુલાયમ બનાવેલ આ ઓરડાની દીવાલો આભલાં ભરેલ ભાતીગળ ચકળાથી શોભતી હતી. ભાતીગળ તોરણો પણ ઓરડા ઉપર જૂલતા હતા.

ભગવાન શ્રીહરિના કંઠમાં સુંદર અને સુગંધિત ગુલાબના પુષ્પનો હાર શોભી રહ્યો હતો. કાળા કામળા પર રહેલ શ્રીમદ્ ભાગવતના ગ્રંથની કથા ચાલતી હતી અને શ્રીજમહારાજ તેમાંથી રહસ્યના અધ્યાત્મો સમજાવતા હતા.

બરાબર તે જ સમયે કવિરાજ લાડુદાનજી અને તેમના મામાએ દરબારગઢમાં પ્રવેશ કર્યો. રાજીવી સમા દીપતા એ જુવાન અસવારને જોઈ એભલખાચર તરત જ ઊભા થઈ ગયા. તેમના માણસોને તેમણે ઈશારો કર્યો. તેઓએ તરત જ આવેલ અસવારોની સામે જઈ તેમના ઘોડાની લગામ પકરી લીધી. પછી એભલખાચર તેમને મળ્યા અને ભેટચા. લાડુદાનજીનો હાથ પકડી શ્રીજમહારાજ પાસે લઈ આયા.

કવિરાજ લાડુદાનજીએ સોનેરી કિનખાબનો મોટો ઘેરવાળો ગુલાબી રંગનો પગના કંડા સુધી લાંબો જામો પહેર્યો હતો. સાચી લીલી અતલસનો હીરની નારીવાળો પાયાખામો પહેર્યો હતો. બુરાનપુરી સોનેરી કસુંબલ કેટાની મારવાડી ઢબ્બી બાંધેલી બેઠ, બેઠમાં કચ્છી કારીગરીવાળો સોનાની મૂઢવાળો મોટો કટાર ખોસ્યો હતો. લીલા મખમલનો જીંક, સતારા ભરેલ કચ્છી કારીગરીની ઉત્તમ હમેલ, હમેલના કમરપદ્મામાં સોનેરી મૂઢવાળી મખમલના ઘ્યાનવાળી દેશણસાઈ કચ્છી તલવાર શોભતી હતી. કંઠમાં સોનાનો ઢૂપીઓ, મોહનમાળા અને કચ્છના રાવે આપેલ નવગ્રહનો કંઠો, કાનમાં હીરાજિત મારવાડી બૂટિયું, નંગજિત ઠોળિયાં, સાચા મોતીવાળી છેલકડી, બંને જુલ્હા ઉપર બાજુંધો, સિંહના મોરાવાળા હેમના કડા, પગમાં સોનાનો તોડો વગેરે શાંકાર સજ્યા હતા. વિશાળ ભાલમાં કુમકુમનો ચાંદલો શોભતો હતો. નેત્ર વિશાળ હતા. નેત્ર ઉપરની બે ભામરો કાળી અને વંકાયેલી હતી. વાંકડી મૂછી, ભરાવદાર મુખ, મહાકાય કવિશ્રી લાડુદાનજીને જોઈને દરબારગઢમાં બધા માગ દેવા લાગ્યા.

ભગવાન શ્રીહરિ સભામાં ભાગવતના પ્રસંગોની વાતો કરતા હતા. આવી દિવ્ય સભામાં લાડુદાનજીએ પ્રવેશ કર્યો. સૌ તેમનો તરફ જોવા લાગ્યા. તેમનો આવો રાજશાહી રજોગુણી પોશાક જોઈ સભામાં સૌને લાગ્યું કે કોઈ રાજીવી મહાપ્રભુ

શ્રીહરિના દર્શને પથાર્યા લાગે છે. કવિશ્રીના નેત્રો શ્રીજમહારાજની મૂર્તિ જોતા જ મહારાજના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. તેમણે જોયું કે, ભગવાન શ્રીહરિના કંઠમાં ગુલાબનો હાર હતો, કાળા કામળા ઉપર ભાગવત હતું. પૂર્વાભિમુખે શ્રીજમહારાજ બિરાજમાન થયા હતા. ભગવાન શ્રીહરિની અતિશય આનંદિત અને પ્રકૃષ્ટિલિત સુખકળણ યુક્ત કિશોર મૂર્તિને જાણે પૂર્વની ઓળખાણ હોય તેમ સ્થિત વેરતા કવિરાજ લાડુદાનજી અનિમેષ દસ્તિએ નિહાળી રહ્યા. શ્રીજમહારાજ તેમને બોલત્યા : “આવો લાડુદાનજી !” એમ કહી પોતાના કંઠમાં પહેરેલો ગુલાબનો હાર તેમને પહેરાવ્યો.

લાડુદાનજીને લાગવા માંડયું કે મીઠાની કોથળી ઓગળતી જાય છે. પછી શ્રીજમહારાજે કહ્યું : “એમલબાપુ ! કવિરાજ લાડુદાન ભાવનગરથી આવે છે તો તેમનું યથાયોગ્ય સન્માન કરજો.” પછી બાજુમાં આસન પર બેસાડી કવિરાજની અથથી ઈતિ સુધી સમગ્ર કારકીર્દ સહુ સ્તોત્રાઓ સમક્ષ કહી સંભળાવી. અંતે કહ્યું : “ઠીક, ભવે આવ્યા, તમે તો અનાદિથી અમારા જ છો અને અમારા જ રહેશો. લ્યો ઓળખો.” એમ કહીને મહારાજે પોતાના બંને ચરણારવિદો લંબાવ્યા. બંને પગમાં મળીને સોળ ચિન્હો લાડુદાનજીએ સર્ગી આંખે સંકલ્પ મુજબ નીરખ્યાં અને તેમના મુખમાંથી શંદો સરી પડ્યા :

‘કમળ ધ્વજ અંકુશ જવ વજ તિદરિખ,
આષકોણ સ્વસ્તિક નય દચ્છિન પદ ચિહ્નન દેખ;
ગોપદ ધનુષ મિકોણ મછ ચંદ્ર કળશ નભ સાત,
ચિહ્નન વામ પદ ચિંતવો, પુરખોતમ સાક્ષાત.’

કવિ લાડુદાનજીના અંતરમાં પ્રકાશ થઈ ગયો. પોતાનો ભાવ ભુલાઈ ગયો અને તેમના અંતરમાંથી ઊર્મિઓની સરયાણી ફૂટીને, વાણી રૂપે ખમાચ રાગમાં વહેવા લાગી : ‘આજની ઘડી રે, ધન્ય આજની ઘડી; મેં નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી...’

તેમનો ગ્રેમ અને નિશ્ચય પ્રથમ દર્શને પણ કેવો દંડ હતો, તે ઉપરના જ પદની અંતિમ પંક્તિમાં પણ વધુ સ્પષ્ટ થાય છે : ‘શાન કુંચિ ગુરુગમસે, ગચ્છાં તાળાં ઉઘડી; લાડુ સહજાનંદ નિહાળતાં, કરી આંખડી રે.’

સભા આશ્ર્યવત્ત કવિરાજ લાડુદાનજીનું પરિવર્તન નિહાળી રહી. બે ઘરી પહેલાં રાજવી જેવા દેખાતા પડછંદકાય આ પુરુષનો રજોગુણ અહીં ઓસરી ગયો હોય તેવું સૌને લાગ્યું. સાહિત્ય, સંગીત અને કલાના જ્ઞાતા, મહાબુદ્ધિમાન, રજવાડાંઓએ પણ જેમની વિદ્વતાનું બાહુમાન કર્યું હતું એવા કવિરાજ લાડુદાનજી ભગવાન શ્રી સ્વામિનારાયણની નીરખતાં

જ, શાનકુંચી પ્રામ થતાં જ, જાણે અજ્ઞાનના અંધારા બેદાઈ ગયા હોય તેમ બે હાથ જોડી ભગવાન શ્રીહરિની ક્ષમા માંગી. ત્યારે શ્રીજમહારાજે કહ્યું : “લાડુદાનજી ! હજુ તો અમારે તમારા દ્વારા ઘણા કાર્યો કરાવાના છે.”

કવિશ્રીના મામા, ભાણેજનું આ પરિવર્તન જોઈ જંખવાણા પડી ગયા. લાડુદાનજી છેલ્લી પંક્તિ બોલતાં જ સમાધિમાં ચાલ્યા ગયાં. સાથે આવેલા મામા તો ભાણેજની આ પરિસ્થિતિ જોઈ ધર ભણી ઉતાવળા પગ કરી જવાનું વિચારવા લાગ્યાં.

ભાવવિભોર દશામાં લાડુદાનજીને સમાધિમાં અક્ષરધામસ્થ દિવ્ય શીતળ અને મહાતેજમાં પૂર્વ પુરુષોત્તમ નારાયણનાં સાક્ષાત્ દર્શન થયાં. તે દિવ્યધામમાં બાપુ એમલબાયરના દરબારમાં લીંબતરુ નીચે બિરાજમાન ભગવાન શ્રીહરિ તેમણે જોયા હતા તે જ શ્રીહરિ અતિ પ્રકાશમય, અતિ આંનદરૂપ દિવ્ય સ્વરૂપે તેમને દેખાયા. તે સ્વરૂપમાંથી ધીરે ધીરે અવતારો પ્રગત થયા. અને તમામ અવતારો પાછા શ્રીજમહારાજની મૂર્તિમાં લીન થતાં જોયા. લાડુદાનજીને સમાધિમાં પોતાને દંડ નિશ્ચય થયો કે આ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી, સર્વકારણના કારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત્ નરદેહ ધરી આ પૃથ્વી ઉપર પ્રગત થયા છે તે પ્રગત પ્રભુ આજે મને મળ્યા છે તેમ નિશ્ચય થતાં પોતે સમાધિમાંથી જગ્યાત થતાં ચારણી કાવ્યનો એક છપય છંદ રચી શ્રીજમહારાજને સંભળાવ્યો :

‘એહી મચ્છ એહી કચ્છ, એહી સૂક્ર તનુ ધાર્યો;
એહી બને નરસિંહ, દુષ્ટ હરના કંસ માર્યો.
એહી વામન પવુ કીન, લીન પદ તીન બુવનત્રય;
એહી ફરસીધર રામ, એહી રઘુપતિ કિય જગજય.
એહી કૃષ્ણ લુંઝ નકલંક એહી, તેહી ભેટન બ્રમ ટલે;
કીતનેક રૂપ લાડુ કહે, સો ચંદ સહજાનંદ મીલે.’

પછી મહાપ્રભુ શ્રીહરિના ચરણકમળમાં સાણંગ દંડવત્ત પ્રણામ કર્યા. શ્રીજમહારાજ તેમને ઊભા થઈને ભેટચા. તેમની બંને આંખોમાંથી હર્ષશ્રુ ચાલ્યા જતા હતા. તે ભાવવિભોર સિથિતમાંથી બોલ્યા : “આ જ, આ જ સ્વરૂપ ! પ્રભુ ! મેં દિવ્ય અક્ષરધામમાં આ જ સ્વરૂપ જોયું. આ સ્વરૂપમાંથી મચ્છ, કચ્છ, વારાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રઘુનાનાથજી અને શ્રીકૃષ્ણ સર્વ અવતારોને નીકળતા મેં જોયા. પછી આ જ સ્વરૂપમાં તેમને સૌને લીન થતા જોયા. પ્રભુ ! મને આપે ન્યાલ કરી દીધો.”

સાંજે સભા થઈ. સૌને કવિશ્રીને સાંભળવાનો લોભ હતો. લાડુદાનજીના બુલંદ અવાજમાં, ચારણી હલકમાં સૌને કાંઈક અપૂર્વ ખુમારી જણાતી હતી. તેથી સાંજની સભા હક્કેઠેં

ભરાઈ ગઈ. તસુ જેટલોય ક્યાંય માગ રહ્યો નહિ. ભગવાન લેવો?”

શ્રીહરિ લીંબતરુ નીચે પાટ ઉપર બિરાજમાન થયા હતા. સર્વ ધૈત વસ્ત ધારણ કર્યા હતા અને અંગમાં પુષ્પોના શાખાગાર શોભતા હતા. પછી કવીશ્વર લાડુદાનજીએ મેઘની ગર્જના જેવા બુલંદ અવાજમાં ‘રૂપમુકુંદ’ છંડમાં રચેલું કવિત લલકાર્ય. કવિના નાદને તાલ દેતા મોરલાઓ પણ ‘ગેહુક... ગેહુક’ ગહેકવા લાગ્યા. અવતારોના સ્વરૂપના વર્ણના છંદો સભા સાંભળે, કવિરાજ તેનું વિવરણ કરે અને સાથે સાથે મહાપ્રભુ શ્રીહરિની મૂર્તિમાંથી તે અવતાર પ્રગટ થાય અને પાછા તે મૂર્તિમાં લીન થાય. શ્રીજમહારાજનું આવું અદ્ભુત ઐશ્વર્ય સભાએ જોયું. કવિરાજને પણ તેમનું કવિત પ્રગટ થતું, એકાર લેતું લાગ્યું. તેમના આનંદનો પાર ન રહ્યો. સમગ્ર સભા તે દિવ્ય આનંદમાં મુગ્ધ બની ‘સો સહજાનંદરૂપ સાહી’ એ ઉદ્ઘોષમાં બરખાસ્ત થઈ.

કોઈ સમયે કાચિયાણી ગામમાં બિરાજતા ભગવાન શ્રી સ્વામિનારાયણો કવિરાજ લાડુદાનજીની પ્રતિષ્ઠા, સન્માન અને વિદ્ધતાના અહંક જોઈ તેમને કહ્યું: “કવિરાજ! એક કપકં કામ આપને સૌંપવું છે. એભલબાપુની જુવાન ટીકરીઓ ગૃહસ્થાશ્રમમાં જોડાવાની ના ભણે છે. તમે ધારો તો આ બહેનોને ગૃહસ્થાશ્રમી બનાવી શકો. માટે તમે કામ પાર પાડો.” કવિએ પોતાનાં વાક્યાતુર્ય અને બુદ્ધિના ગર્વથી કહ્યું: “સહજાનંદ સ્વામી! એમાં શું મોટી વાત છે? સહેજમાં કામ પાર પડ્યું સમજો...”

તેમણે ગટડા પહોંચી એભલબાપુને મળી જીવુબા તથા લાડુબાને સમજાવવાની ગોઢવણ કરી. સાંઘધ્યમી-(ત્યાગ પરાયણ)બંને બહેનો પડદા પાછળ કવિના ચાતુર્યની એરેણે ચડી. કવિરાજે તેમને સંસારમાં વૃત્તિ જોડી પતિપરાયણ થઈ સેવાભક્તિ કરવા સમજાવ્યું. ગૃહસ્થાશ્રમ પરમ પ્રમાણે પહેરવું-ઓઠવું, ગૃહસ્થાશ્રમ કરવો એ ફરજ સમજ તેમ વર્તવામાં મા-બાપનીને ઈંટેની લાજ વધે છે.

લાડુદાનજી અટક્યા એટલે બંને બહેનોએ વિનયી સ્વરે વૈરાગ્યની વાતો શરૂ કરી: “કવિરાજ! અનંત જન્મમાં એ કરીને જ આવ્યા છીએ. તેમાંથી છૂટવાનો આ અવસર આવ્યો ત્યારે રૂપની સજાવત કરવી, સંસાર માણવો એવો ઉપદેશ તમે વિદ્ધાન થઈને આપો છો? પૂર્ણપુરુષોત્તમ સાક્ષાત્ મળ્યા પછી સંસારનો મોહ શા માટે? રજોશુષી બની, દેહ સજાવી, તેના મોહમાં, તેના અભિમાનમાં હુલાવું? દેહ તો વિષાની ખાણ છે. અંતે નાશ થઈ જશો. ભગવાન શ્રીહરિની ભક્તિ કરી મોક્ષ સાધવાના સાધનરૂપે જ તે આપણને મળ્યો છે. શા માટે તેનો ઉપયોગ તેમાં ન કરી

ભક્તિરસથી સભર, વૈરાગ્યનો રંગ ચડાવી દે તેવી અદ્ભુત વાતોથી કવિ ઊંડા ઊતરી ગયા. કાયા પલટાઈ ગઈ. તેમણે સીધી જ કાચિયાણીની વાટ પકડી. કાચિયાણીમાં વસ્તાખાચરના દરબારની ડેલી ઉઘાડતાં જ સામે સિમત કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણને ઊભેલા જોયા. દડવત્-પ્રશામ કરી ઈષ્ટદેવનાં ચરણમાં માથું મૂક્યું. ઊભા થઈ આભૂષણો ઉતારી ચરણમાં મૂક્યાં. દશ શેરના સુવર્ણ આભૂષણાં ઢગલા પર, ઢાકાનો મલમલનાં સોનેરી તારથી ગૂંઘેલા વણો ગોઈવાયાં. અંતર્યામી ભગવાન શ્રીહરિ આશ્વર્યપૂર્ણ નયને જોતા રહ્યા. હળવેથી પૂછ્યું: “લાડુદાનજી! આ શું કરો છો?”

તારે લાડુદાનજીએ કહ્યું: “મહારાજ! કરવાનું છે તે તો હવે થશે. અત્યાર સુધી આડમાર્ગ આથડચો, હવે ટેકાણો આવ્યો છું. બંને બહેનોનો રંગ મને લાગ્યો. હવે કૃપા કરો અને દીક્ષા આપો.” પછી મહારાજે વૈરાગ્યની તીવ્રતા જોઈ કાણાય વણો મંગાવી દીક્ષા આપી. ‘શ્રીરંગદાસજી’ એવું નામકરણ કર્યું.

ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે શ્રીરંગદાસજીને દઢ આત્મીયતા બંધાણી હતી. એમ બંનેની મિત્રભાવે ગોઠી જામે. કાઠી, ગરાસદારો અને શ્રીરંગદાસજી હોય ત્યારે રમૂજ-આનંદની છોણો ઊડતી. ભગવાન શ્રીહરિ એ રમૂજ વચ્ચે અદ્યાત્મની વાતો ગોઠી ટેતા.

બીજી તરફ શ્રીરંગદાસજીનું કવિકાર્ય પણ ગતિમાં હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણની અદ્ભુત મૂર્તિનાં વર્ણનો, ત્યાગની સમજજ્ઞાનાં પદો, સંતમહિમાનાં પદો વગરે એક-એકથી ચઠિયાતાં ભક્તિપદો સૌમાં અનેરો રંગ લાવવા લાગ્યાં. આ બધાં પદોના અંતે ‘શ્રીરંગદાસ’ નામ ઊચિત બેસંતું નહોતું. એમાંય વળી મહારાજે પાંચસો પરમહંસોની દીક્ષામાં શ્રીરંગદાસજીને પણ પરમહંસ દીક્ષા આપી. આ પ્રસંગે ભગવાન શ્રીહરિએ તેમને શ્રીરંગદાસજી નામ બદલીને ‘બ્રહ્માનંદ’ એવું સાનુક્ષી નામાભિધાન કર્યું. એ વાત સદ્દ. બ્રહ્માનંદ સ્વામી નોંધતા કહે છે: ‘લાડુ મેટકે શ્રીરંગ નામ ધર્યા, દોઉ લીન બ્રહ્માનંદ નામમે જુ; ચિત ધાર સહજાનંદ શ્યામ છબી, જગ જુત ગયો નિજ ધામમે જુ.’

સદ્દ. બ્રહ્માનંદ સ્વામીના જીવનના અનેક પ્રસંગો એક અલગ ગ્રંથ બની શકે તેવા અને ખૂબજ સુંદર છે. એમના કાર્યો, એમનું જીવન તેમજ સ્વામીની વાણી અને વ્યવહાર કુશળતા ખૂબજ રસપદ પ્રસિદ્ધ છે.

* * *



ભાવનગરના પરમ ભક્તરાજ દૈર્યવાન શ્રી રૂપાભાઈ

ભાવનગરમાં ક્ષત્રિય જ્ઞાતિના રૂપાભાઈ સારા સત્સંગી હતા. શ્રીજમહારાજના સ્વરૂપની દેખનિષાનું બળ બહુ જ હતું. અને ભજન-સ્મરણ કરવાનું ખાસ અંગ હતું. ઘોર વિપત્તિમાં પણ સ્થિર ચિંતાથી શાંતિપૂર્વક ઉત્સાહથી પ્રભુભક્તિની કરતા. કોઈપણ પ્રકારના પ્રલોભનોમાં નહિ લોભાતા પોતાને સોંપાયેલા કાર્યને પ્રામાણિકપણે પાર પાડતા. એથી એમનો ચંચળ ચોતરફ ફેલાયેલો હતો અને સજજન પુરુષોને એમનો પૂર્ણ વિશ્વાસ હતો. તેથી તેઓને કેટલાય જવાબદારીવાળા જોખમ ભરેલા કાર્યો કરવા પડતા. તેમાં રૂપાભાઈ દરેક સંતોષ પામે તેવું ઉત્તમ વર્તન રાખી નીતિથી કામકાજ કરતા હતા. આ રીતે રૂપાભાઈનું ધર્મભય નીતિપ્રધાન જીવન તથા નિરાભિમાનપણું જોઈને લોકો એમની પ્રશંસા કરતા. તેઓ ભાવનગર રાજદરબારમાં નોકરી કરતા એટલે દરબાર પણ રૂપાભાઈની પ્રામાણિકતા જોઈને તેમના પર ધ્યાન જ ખુશ રહેતા.

સજજન પુરુષો કોઈનું અહિત કરતા નથી, તેમ કોઈને અડચણારૂપ પણ થતા નથી. બને તેટલું તેઓ દરેક પ્રાણીનું ભલું જ કરે છે, છતાં પણ સ્વાર્થી-પ્રપંચી અને અદેખા લોકો પોતાની મહિન મુરૂદ પૂરી ન થાય એટલે ખોટી રીતે અનેક કૌભાંડો રચી સજજન પુરુષોને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસો કરતા જ રહે છે

પણ વિશાળ ભાવનાવાળા સજજન પુરુષો કોઈનું ખૂસું થાય તેવો સંકલ્પ પણ કરતા નથી. તેથી તેઓ દુર્જનોની કુટિલતા જોઈને પરમાભા તેને સદ્ભુદ્વિ આપે, પ્રભુ તેનું સારું કરે - આ પ્રકારે આર્તાટે પ્રાર્થના કરે છે. પરંતુ 'પરસુખ દેખી પરજો પરદુઃખથી અતિમોદ, નિત્યકર્મ ચે નીચનું માને મહા વિનાદ...'

આ જાતની હલકી ટેવ કે પ્રકૃતિવાળા માણસો પોતાનું હિત કરનાર તરફ પણ વિપરીત બુદ્ધિથી જુબે છે. રૂપાભાઈ કોઈનું અહિત ન થાય એ રીતે સરળતાથી રહેતા હતા, પણ તેમની યોગ્યતા જોઈને સારા માણસો તેમને માન-સન્માન આપે, વખાણ કરે અને ખૂબ દરબાર સાહેબ પણ માનભરી દસ્તિથી જુબે તે કેટલાક લોકોથી જોઈ શકતું ન હતું. તેથી અવારનવાર નબળા માણસના પાસવાનો (પાસે રહેનાર - હજૂરીઓ) રૂપાભાઈની વિરુદ્ધમાં દરબારને કદ્યા કરતા હતા. ધણે ભાગે મોટા માણસો કાનના કાચા હોય છે અને મનુષ્યની પ્રકૃતિ પણ એવી હોય છે કે તલસ્પર્શી તપાસ કર્યા વિના ઉપલબ્ધ દસ્તિથી જોયેલી કે સાંભળેલી વાત યથાર્થ માની લે છે, તેથી ખટપટિયા લોકો ફાવી જાય છે.

સાત્ત્વિક વૃત્તિવાળા મનુષ્યને સત્ત્વગુણ પ્રધાન કાર્ય હોય

એ જ હંમેશા કરવું સારું લાગે છે, એટલે એ રાજ્યાનુભાવ વૃદ્ધિ પામે તેવા પ્રસંગોથી દૂર જ રહે છે. રૂપાભાઈ જો કે દરબારી નોકરી કરતા હતા, તોપણ પોતાની નિર્મણવૃત્તિમાં આહાર-વિહારમાં ફેરફાર ન થાય એ રીતે યુક્તિથી સાવધાનપણે રહેતા હતા.

એકવખત તેમના ઉપર અદેખાઈવાળાએ દરબારને ભરાવ્યું કે, “રૂપાભાઈ આપની નોકરી કરે છે અને શિકાર કરવા કેમ નથી આવતા? નોકરી કરવી ને શિકાર ન કરવો એ કંઈ ચાલે? સૌની સાથે આવવું જ જોઈએ, આ વખતે શિકારમાં તેને પણ આપ સાથે લો.” અદેખા લોકો બીજી બાબતમાં જ્યારે ન ફાયા ત્યારે આ એક નબળી બાબતને આગળ ધરી દરબારના કાન ખૂબ બંન્ધેર્યા. તેથી દરબારે રૂપાભાઈને કહ્યું : “આજ તમારે અમારી સાથે શિકાર કરવા આવવાનું છે.” ત્યારે રૂપાભાઈએ હા કહી. પછી જંગલમાં દરબારની સાથે ગયા. જંગલમાં દૂર જતાં એક સૂવર જોવામાં આવ્યો તેની પાછળ બધા ઘોડેસ્વારો દોડ્યા, એટલે તે સૂવર ઘાટી ઝડીમાં જઈ કરમદીના હુવામાં પેસી ગયો. પછી દરબારે કહ્યું : “હવે બધા ઘોડેસ્વારો ચોતનફ ઊભા રહો, જેની પાસેથી સૂવર નીકળો, તેણે મારવો.” એમ કહી સાથે બંદૂકોના અવાજ કરાવ્યા. તેથી સૂવર એકદમ હંફળો-ફંફળો થઈને દૈવ ઈચ્છાથી રૂપાભાઈની પાસેથી નીકળ્યો. એટલે રૂપાભાઈએ બંદૂકનો ધા જરા જિંયેથી કર્યો, તેથી સૂવરને લાગ્યો નહિ. ત્યારે બીજાઓ દરબારને કહ્યું : “નામદાર! રૂપાભાઈએ સૂવર ઉપર બંદૂકનો ધા ન કર્યો અને અમસ્તો જિંયેથી વાજ કરી નાખ્યો છે.” દરબારે પણ આ બધું નજરે દીઠેલ તેથી એકદમ ગુસ્સે થઈને તૂર્ટ જ રૂપાભાઈને નોકરીમાંથી રજા આપી દીધી!

માણસનું અપમાન થાય અથવા આજીવિકા તૂટી જાય ત્યારે તે મુંજાઈ જાય છે અને ધીરજ તથા વિવેક ખોઈ બેસોને ચિંતામાં પડી જાય છે; એટલે વિષમ વેળાએ સમજાણી સુખી રહી વિશેષપણે દેર્ય ધારણ કરી પરમાત્મા શ્રીહરિનું સ્મરણ કરવું જોઈએ. તેને બદલે ઊલટા પરમાત્માને ભૂલી જવાય છે. રૂપાભાઈ અપમાનિત થઈ નોકરીમાંથી છૂટા થયા, તોપણ કોઈ પ્રકારનો મનમાં ખેદ ન કર્યો. એ કંઈ પોતા પાસે થોરીધણી મૂરી હતી, તેમાં સંતોષપૂર્વક કરકસરથી વ્યવહાર ચલાવી દ્યાનભજન કરવા માંડ્યા. આ રીતે અમણે છ માસ સુધી ધેર બેઠાં ભગવાન શ્રીહરિ સમજ્ઞ ભજન કર્યું. ત્યાં એક મંસંગ એવો બન્યો કે, દરબાર સાહેબના રાણીએ ગંગાજની યાત્રા કરવા જવાનો વિચાર કરી દરબારને કહ્યું : “અમારે ગંગાજની યાત્રા કરવા જવું છે માટે અમારી સાથે કોઈ સારો માણસ મોકલ્યો.” આ બાબતમાં દરબાર વિચાર કરતા હતા, તેવામાં ખાનગી દીવાન જૂનાગઢના નાગર હતા તેમણે કહ્યું : “નામદાર! દરેક

રીતે કુશળ ને પ્રમાણિક-સાચો માણસ તો એક રૂપાભાઈ છે, પણ તેને તો આપે પગાર બંધ કરીને રજા આપી છે.”

પછી દરબારે રૂપાભાઈને બોલાવી છ મહિનાથી જે પગાર બંધ કર્યો હતો તે એકી સાથે આપી દીધો અને કહ્યું : “રૂપાભાઈ! રાણીસાહેબને જાત્રા કરવા જવું છે માટે તમે સાથે જાઓ.” ત્યારે રૂપાભાઈ કહે : “હું સાથે જાઉ પણ મને પૈસાનો હિસાબ બરાબર આવડતો નથી, માટે કોઈ સારા ગુમાસ્તાને સાથે મોકલ્યો.” એટલે દરબારે એક ગુમાસ્તાને સાથે મોકલ્યો અને રૂપાભાઈને ખર્ચ માટે પૈસા આપ્યા. પછી રૂપાભાઈ સાઠ માણસોનો સંઘ લઈને ગંગાજની યાત્રા કરવા રવાના થયા. માર્ગમાં ભોજન વગેરેમાં જે કંઈ ખર્ચ થતું તે રૂપાભાઈ હંમેશા ગુમાસ્તા પાસે લાભાવી લેતા. રસ્તામાં જે તીર્થો આવે તેના દર્શન કરતા કરતા કાશીએ પહોંચ્યા. ત્યાં ગંગાસ્તાન અને વિષિસર શ્રાદ્ધ કરાવ્યું અને બ્રહ્મભોજન કરાવી બે-ચાર ટિવસ વિશ્વાંતિ લીધી. પછી ત્યાંથી રવાના થયા. એક ટિવસ રાનિએ રૂપાભાઈને રાણીએ બેસવા બોલાવ્યા ત્યારે તેમણે કહેરાવ્યું કે, “અત્યારે નહિ, સવારે આવીશો.” રૂપાભાઈ ન ગયા તે રાણીને જરાપણ ઠીકન લાગ્યું અને મનમાં આંદી બંધાઈ ગઈ.

વિચારશીલ ખાનદાન મનુષ્ય પણ જો સાવચેત ન રહે તો સંયોગનું બળ અનું મહાન છે કે, ભલભલાને પણ ભૂલ ખવરાવી દે છે. એ હેતુથી શાખકારો લખે છે કે, ‘મા-બહેન ને દીકરી તેની સાથે પણ એકાત્માં ન રહેવું. કારણ કે ઈન્દ્રિયોનો સમુદ્દરાય મહાબળવાન છે, તેના વિશ્વાસથી ગાફલાઈ રાખવી જ નહિ.’ આ વસ્તુ ઘણા અનુભવો બાદ લખાયેલી છે. પરંતુ પોતાની સ્વિતિનું પણ જેણે ભાન નથી તેવા બીન અનુભવી લોકો થોડું જાણ્યા પછી હું પણ કંઈક છું એમ માની અસાવધાન રહે છે, તેથી એ હરવખત ભૂલાને પાત્ર બનતા રહે છે. રૂપાભાઈમાં રૂપ, ગુણ, સેવાભાવ અને સરળતા વગેરે સદ્ગુણો હતા.

રાણીની આજી છતાં રૂપાભાઈ મક્કમ રહ્યા અને પોતાના ધાર્મિક નિયમમાં ફેરફાર થવા દીધો નહિ. આ રીતે કુશળતા પૂર્વક યાત્રા કરી સૌ ઘેર આવ્યા. રૂપાભાઈએ રીતસર નામું કરી વધારાના પૈસા તૂર્તજ દરબારને આપી દીધા. તેથી દરબાર ખુશી થયા ને ઈનામ આપ્યું તેમજ પગાર પણ વધારી આપ્યો. પરંતુ રાણીના મનમાં આંદી બંધાઈ ગઈ હતી તેણે દરબારને આંદુઅવણું સમજાવી રૂપાભાઈને નોકરીમાંથી રજા આપાવી દીધી ! પછી રૂપાભાઈ ઘેર રહી ધીરજથી આનંદપૂર્વક શ્રીજમહારાજનું દ્યાન-ભજન કરવા લાગ્યા. એક વર્ષ પર્યન્ત ભગવત્સમરણ કર્યું, ત્યાં એવું બન્યું કે લૂજમાં કોઈ કુશળ કારીગર પાસે દાગીના ઘાડાવવા માટે માણસને મોકલવો હતો. તેથી દરબારે પોતાના ખાનગી દીવાનને પૂછ્યું : “દાગીના ઘાડાવવા એ જોખમી કામ કહેવાય, તો કોને મોકલીશું ? આ

કામમાં કોઈ સાચા માણસની જરૂર છે.” ત્યારે દીવાને કહ્યું : “પ્રામાણિક માણસ મળવા કઠિન છે, એવા તો એક સ્વામિનારાયણના સત્સંગી રૂપાભાઈ છે. પણ તેને તો આપે નોકરીમાંથી છૂટા કર્યા છે.” દીવાનની વાત સાંભળી દરબારે રૂપાભાઈને બોલાવીને કહ્યું : “તમારો વર્ષ દઢાડાનો પગાર ચક્કો છે તે લઈ જાઓ અને આપણે ભૂજમાં દાગીના ઘડાવવા છે, તો તમે તથા એક ગુમાસ્તો ને એક સોની સાથે લઈને જામનગરથી મોતી લઈ ભૂજ દાગીના ઘડાવી લાવો.” ત્યારે રૂપાભાઈએ કહ્યું : “જુ નામદાર ! બહું સારું જેમ આપ હુકમ કરશો તેમ કરીશા.” એમ કહી બીજે ટિવસે તેયાર થઈને ચાલ્યા. જામનગર જઈ મોતી લીધા, ત્યારે ગુમાસ્તાએ કહ્યું : “રૂપાભાઈ ! હવે આપણે ખરો લાગ આવ્યો છે, ને તેમને તો દરબાર વારે વારે કાઢી મૂકે છે મારે આપણે સહુને મળીને આમાંથી કંઈક કાઢી લેવું જોઈએ.” ત્યારે રૂપાભાઈ કહે : “મારાથી કંઈક પણ લેવાય જ નહિ, નેહું સાથે છું તાંનું સુધી તમારાથી પણ કંઈ લેવાશે નહિ. આપણાને ન્યાયથી જે પગાર મળે છે તે ઘણો છે!!” એમ સહુને યોગ્ય રીતે સમજાવી મોતી વગેરે સામાન લઈ ભૂજ ગયા ને ત્યાં ઘણો સમય રહી દાગીના ઘડાવ્યા.

પછી ભાવનગર આવી દાગીના દરબારને સોંઘા. દરેક વસ્તુમાં ભાવ, ઘડામણ વગેરેનું ખર્ચ થયું હતું તેની દાગીનાના જાણકાર માણસો પાસે દરબારે ખાલગી તપાસ કરાવી. તેમાં ઓછા ખર્ચ સારો માલ લઈ શ્રેષ્ઠ કામ થયું છે એવો અભિપ્રાય આવ્યો. આથી દરબાર ઘણા રાજ થયા અને રૂપાભાઈને ઈનામ આપી પગાર પણ વધારી આપ્યો. આમ તેઓનું સંન્માન થતું જોઈને હુદ્દ લોકો દાજીવા લાગ્યા કે ‘અરે ! આનું શું કરતું ? દરબારે તો એમને ઈનામ આપી ભારે સંન્માન કર્યું. માટે હવે વેળાસર કંઈક યુક્તિ શોધી કાઢી આ વાતને આગળ વધવા દેવી ન જોઈએ.’

એકવખત દરબારને ત્યાં વિવાહ હતો. તે પ્રસંગે બહારગામથી ઘણા મહેમાનો આવ્યા હતા. જુના રિવાજ મુજબ રાજદરબારમાં મોતી કચેરી ભરાય ને તેમાં એકબીજાને આગ્રહ કરીને કચુંબા તથા દારુ પાતા હતા. દરબારી કચેરીમાં અમીર, ઉમરાવ, નોકર વગેરે સૌને હાજરી આપવી જ જોઈએ એ રાજરીત પ્રમાણે કચેરી-વિવાહ પ્રસંગની કચેરી ભરાઈ. અને પરસ્પર એકબીજાને સોંંદ આપી આપીને દારુ પાઈ રહ્યા હતા. એ કચેરીના જલસામાં રિવાજ મુજબ રૂપાભાઈને પણ આવતું પડ્યું. એટલે બરાબર સમય વર્તી પેલા હલકા માનસના લોકોએ દરબારને કહ્યું : “નામદાર ! આ રૂપાભાઈને આપના હાથથી પાલી આપો, એ બીજાના હાથથી પીશે નહિ.” ત્યારે ખૂદ દરબાર દારુની ઘાલી હાથમાં લઈ ઊભા થયા ને રૂપાભાઈને દારુ પીવાનો આગ્રહ કરવા લાગ્યા. આ જોઈ રૂપાભાઈ કહે :

“બાપુ ! હું તો ભગવાન શ્રી સ્વામિનારાયણનો સત્સંગી છું, મારે એ વસ્તુ હરામ છે.” ત્યારે પેલા દેખીલા લોકો કહે : “અરે ! ભાવનગરના ઘણીનો હાથ પાછો ડેલાય નહિ.” એમ કહી ચોતરફથી ઘેરીવળીને અતિ આગ્રહ કરી શરમાવ્યા. અને છેવટે ભય પણ બાતાવ્યો, તોપણ રૂપાભાઈએ દારુ પીધો જ નહિ. તેથી દરબારને ઘણી જ રીસચરી ગઈ.

રાજદરબારમાં એવી રીતે કે, કોઈ દારુ ન પીતો હોય તો છેવટ રાજા પોતે ઊભા થાય એટલે એમનો હાથ કોઈથી પાછો ડેલાય નહિ. જો રાજાનો હાથ પાછો ડેલાય તો ભરસભામાં તેનું અપમાન કર્યું કહેવાય અને તેનું પરિણામ માંહું આવે. એ ડરથી ગમે તેવો હોય તોપણ તેણે સોની સાથે બળવું જ પડે. ખરો બાહાહુર અને ધર્મનિષ્ઠ હોય તે જ કોઈની પરવા કર્યા વિના એ વખતે મક્કમ રહી શકે. ખોટી શરમ અને મહોભતમાં લેવાઈ જઈને ઘણા લોકો અવળે માર્ગ તણાઈ જ્યા છે. એકવખત પણ નબળી બાબતમાં લેવાયા પછી તેમાંથી ઘટું ઘણું જ મુશ્કેલ બનેછે. માટે મુમુક્ષુજ્ઞનોએ કોઈપણ ભોગ યોગ્ય રીતભાતમાં ન લેવાઈ જવાય તેને માટે સતત સાવધાની રાખતા હોય છે. કારણ કે અનંત કાળના પુષ્ય-પ્રયાસે દેવહુલિલ માનવ દેછ મળ્યા પછી જો શરમ, મહોભત, ભય કે ખોટા દાખલમાં દબાઈ જવાય તો આત્મકલ્યાણ જેવું અતિ મહિટયનું કાર્યસિદ્ધ ન થઈ શકે એ મહાન હાનિ થાય. રૂપાભાઈ કોઈથી દબાયા વિના ધર્મનિયમમાં દંડ રહ્યા ને દરબારના હાથથી પણ દારુ ન પીધો. તેથી સભામાં મારું ઘોર અપમાન કર્યું એમ માની દરબારે રૂપાભાઈને નોકરીમાંથી વળી રજા આપી દીધી ! પરંતુ તેઓ નિર્ભયથઈને વિશેષપણે બજન-ભક્તિ કરવા લાગ્યા, પણ કોઈ પ્રકારે અકળાયા નહિ. પરંતુ તેમના પણ્ણીએ કહ્યું : “દરબાર તમોને હરવખત કેમ નોકરીમાંથી ઘૂટા કરે છે ?” ત્યારે રૂપાભાઈ કહે : “ભગવાનની મરજી, આપણે તો સાચી દાનતથી કામ કરવું ને કોઈનું ભૂલું થાય તેવો સંકલ્પ પણ ન કરવો. એમ છિત્તાં જે કંઈ દુઃખ આવે તે સહન કરવું અને સદા આનંદમાં રહી ભગવાન ભજી લેવા. ભગવાન શ્રીહરિ બધું જાણે છે ને આપણું જેમ હિત થાય એમજ કરે છે, પછી આપણે ચિંતા શા માટે કરવી ?”

રૂપાભાઈ નોકરીમાંથી ઘૂટા થયા તેને જ માસ થયા હતા. ત્યાં દેવઈચાલી એક પ્રસંગ એવો બન્ધો કે દરબારે મોટો વાઢ વવરાયો હતો તેમાં એક સિંહ કોઈ સ્થળોથી આવીને પેસી ગયો. તેણે કેટલાક હોર તથા માણસોને પણ મારી નાખ્યાં. એમ બહુજ રંજાડ કરવા લાગ્યો. તેથી માણસો કામકાજ કરી શકે એમ રહ્યું નહિ એટલે ખેડૂતો કોસ છોડી, દરબાર પાસે ગયા અને વાત કરી : “બાપુ ! વાઠમાં સિંહ પેસી ગયો છે તે બહુ જ નુકસાન કરે છે. જે પાડો વાળવા જાય તેને ખાઈ જ્યા છે.” ત્યારે દરબારે કહ્યું :


“પચાસ સાંઠ પોલીસ લઈ જાઓ ને તેને કાઢી મૂકો.” પછી એક બહારુ મોટો જમાદાર હતો, તે સાંઠક શૂરવીર પોલીસો લઈને ગયો અને વાઢની ચોતરફ ઊભા રહી બંદુકોના અવાજ કરાવ્યા. તેથી સિંહ અકળાઈને બહાર આવ્યો ને બે-ચાર ઘોડેસવારોને ચૂંથી નાખ્યાં ! અને પાછો વાઢમાં પેસી ગયો. પછી જમાદારે દરબાર પાસે જઈને વાત કરી : “નામદાર ! એ સિંહ તો ભારે વસમો છે તેણે ચાર સવારને મારી નાખ્યાં.” તે સાંભળી દરબાર વિચાર કરવા લાગ્યા કે હવે તેને માટે શો ઉપાય કરવો ? આ લાગ જોઈને પેલા દેખી લોકોએ દરબારને કહ્યું : “બાપુ ! એ સિંહને પહોંચી વળે એવા શૂરવીર તો એક રૂપાભાઈ છે.” ત્યારે દરબારે રૂપાભાઈને તેડાવીને કહ્યું : “આ તમારો છ માસનો પગાર ચક્યો છે તે લઈ જાઓ ને હવેથી તમારો પગાર ચાલુ રાખવામાં આવે છે.”

વધી સાંજે ફરિથી બોલાવીને કહ્યું : “આપણા વાઢમાં સિંહ ધૂસી ગયો છે તેને તમે જઈને કાઢી મૂકો. તેમાં હથિયાર, માણસો વગેરે જે સંગવડ જોઈએ તે લઈ જાઓ.” ત્યારે રૂપાભાઈ હા પાડીને ઘેર આવ્યા. પરંતુ આખી રાણિ શ્રીજમહારાજનું ભજન કર્યું ત્યારે સવારના ચાર વાગ્યે ભગવાન શ્રીહરિએ દર્શન દઈને કહ્યું : “કેમ ઉદાસ થઈને બેઠા છો ? આવા અનેકને ત્રાસ આપતા હુર પ્રાણીઓનો શિકાર કરવો એ તો ક્ષમિયાનું કામ છે માટે ખુશીથી તૈયાર થઈ જાઓ. દરબારની તલવાર લઈને જાંઝો.” એમ કાઢી શ્રીજમહારાજ અંતર્ધાન થઈ ગયા. પછી રૂપાભાઈ સવારે નાહીધોઈ પૂજાપાઠ કરીને બંગલે ગયા. ત્યાં દરબાર દાટણે કરતા હતા. તે રૂપાભાઈને જોઈને બોલ્યા : “કેમ તૈયાર થઈને આવ્યા છો ન ? હવે તમારે જેટલા માણસો તથા હથિયાર જોઈએ તે લઈ જાઓ.” ત્યારે રૂપાભાઈએ કહ્યું : “આપની જે તલવાર છે તે આપો.” ત્યારે દરબારે તલવાર આપી તે લઈ નીશેક ઘોડેસવારો સાથે રૂપાભાઈ વાડે ગયા ને ત્યાં ચોતરફ સવાર ઊભા રહ્યા. અને પોતે પગપાળા વાઢની અંપલી હતી ત્યાં ઊભા રહ્યા. પછી બંદુકોના અવાજ કર્યા એટલે સિંહ એકદમ આકણો થઈને જાંપલી તરફ ખાલી જગ્યા જોઈને બહાર નીકળવા નાઠો. ત્યાં રૂપાભાઈ ઊભા હતા, તેને જોઈને મોં ફાડી ગર્જના કરતો તે ધર્યો ! એટલે રૂપાભાઈએ કપડાં વીંઠી ખૂબ જાડો કરેલો પોતાનો એક હાથ સિંહના મોશામાં નાખી દીધો, અને તલવાર વડે સિંહને પૂરો કર્યો ! પછી તલવાર લૂઠી, ખ્યાન કરી નાહીધોઈ ઘેર આવી ધોયેલા કપડાં પહેરી દરબાર પાસે ગયા. પરંતુ તે પહેલા તો બીજા સવારો સિંહના કાન તથા પૂછું કાપી લઈ દરબાર પાસે મોજ લેવાની આશાથી પહોંચી ગયા હતા. તેને દરબારે કહ્યું : “રૂપાભાઈ આવે પછી મોજ આપીએ.” તેટલામાં રૂપાભાઈ આવ્યા ને પૂછ્યું તો રૂપાભાઈ કહે : “એ તો અને મોતે મૂંઝો હશે !” ત્યારે બીજા પ્રામાણિક

સિંહાઈઓ હતા તે બોલ્યા : “બાપુ ! એ સિંહને તો આ રૂપાભાઈએ ભારે બહારુરીથી માર્યો છે તે અમે નજરે જોયું છે.” પછી દરબારે મોટી કચેરી ભરી તેમાં રૂપાભાઈને શિરાવાપ તથા ઈનામ આપ્યાં ને પગાર પણ વધારી આપ્યો. અને સૌ સાંભળે તેમ દરબારે કહ્યું : “આ રૂપાભાઈ જેવો પ્રામાણિક, ધર્મનિષ ને ધીરજવાળો માણસ મારા રાજ્યમાં કોઈ નથી. કેટલીક વાર તેને રજ આપી છતા તેના મુખ પર શોક, ચિંતા કે દ્વિપૃષ્ઠ દેખાયાં નથી. તેમ જીવનમાં કોઈ વખતે અવિવેક કે ગર્વ કર્યો નથી. ધન્ય છે એમના ગુરુ લગવાન સ્વામિનારાચણ અને તેમના સંતોને કે, જેમણે દરેક કોમને સુધારી આવા ધર્મનિષ ને નીતિવાળા માણસોનો સમૂહ તૈયાર કર્યો છે. અમે કોઈના કહેવા સાંભળવાથી કે ગેરસમજથી રૂપાભાઈને ઘણીવાર મુશ્કેલીમાં મૂક્યા છે, તેથી મનમાં ખેદ થાય છે.”

આ પ્રમાણે કાઢી દરબારે રૂપાભાઈને કહ્યું : “તમે જીવો ત્યાં સુધી ચાલુ પગાર પ્રમાણે જ દર માસે તિજોરીએથી પગાર લઈ જવો, તમારાથી કામ થાય તેલણું કરવું. સમયસર અવાય ન અવાય તેનું તમને બંધન રહેશે નહિ. ખૂબ શાંતિથી તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુભક્તિ કરો.”

જગતની લાલચોમાં મનને લોભાવા ન ટેવું એ કંઈ મામૂલી વાત નથી. વિષયની આસક્તિ ટણવી એ તો મહામુશ્કેલી ભરેલું અધંક કામ છે. વિદ્વાનોની વિદ્તા, બુદ્ધિશાળીઓની બુદ્ધિમતા અને ચતુર પુરુષોની ચતુરાઈ એ બધું વિષયોના વાવાજોડાં આગળ આકડાના તુરની પેઠે આકાશમાં કયાંય ઊડી જાય છે ! સતત કાળજીપૂર્વક આત્માવલોકન કરી જેણે અંતઃશરૂઆતો સાથે લડતા પ્રતિપણ સાવધાની રાખી હોય, તે જ વિષમ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે. સોનું ને સ્ત્રી એ બે આ જગતમાં મોટા પ્રલોભનો છે. તેમાં ન લેવાવું એ અતિ આકર્ષણ કામ છે, તથા કોઈની શરમ કે મહોબતમાં તણાઈ જતું નહિ એ પણ ભારે કામ છે. રૂપાભાઈને અનેક વિદ્ધનો આવ્યાં, અપમાનો થયાં, આજીવિકા તૂટી ગઈ, સી-દ્રવ્યના પ્રસંગમાં આવ્યા, છતાં પણ ભારે ધીરજપૂર્વક ખૂબ શાંતિથી મહાવિશ્વાસ રાખી જીવનભર અવિકારી રહી ઉત્સાહથી મહાપ્રભુ શ્રીહરિની ભક્તિ કરી અને પોતાનું વિશુદ્ધ વર્તન, સરળ સ્વભાવ અને વિવેક સાથેની વ્યાવહારિક કુશળતા ઈત્યાદિ સહદ્યુષોથી બીજા ઉપર સુંદર છાપ પાડી અનેક જીવને પ્રભુસ્મરણમાં પ્રીતિવાળા અને સદાચારી બનાવ્યા. આપણે પણ આવા ભક્તનોની ‘યશોગાથા’નું સૂક્ષ્મ દાખિથી અવલોકન કરવું જોઈએ. જેથી વિષમ વેળામાં પણ અવિકારી રહી આત્મકલ્યાણ સાધી સત્સંગની સેવા કરી શકીએ. (આદર્શ ભક્તનગાથાચાંથી સાભાર...)



ભાવનગર રાજ્યના નેક નામદાર

પ્રજાપત્સલ-દ્વારાયપ્રિય મહારાજા રાખોલ શ્રી કૃષ્ણકુમારસિંહજી

સૌરાષ્ટ્રમાં ગોહિલવંશે ઈ.સ. ૧૮૫૦ થી ૧૯૪૮ સુધી સાતસો વર્ષ રાજ્ય કર્યું. તે રાજાઓની સાતત્ય ભરેલી ઉજજવલ રાજ્યપરંપરા સાથે બહુ ઓછા રાજવંશોની સરખામડી થઈ શકે તેમ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી આ શાસનપરંપરાના છેલ્લા રાજીવી હતા. દીર્ઘદિન અને માનવતા ભરેલા ચિરંજિવ કાર્યોથી ભારતના ઈતિહાસમાં પોતાનું નામ તેઓ સુવર્ણાશરે અંકિત કરાવી ગયા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રજાપત્સલતા, દીર્ઘદિન, સરેનશીલતા અને પારદર્શક વ્યક્તિમત્તા આકસ્મિક રીતે પ્રગત થયેલ નહોતી. આગળના રાજીવીઓએ જે ગુણો ખીલવ્યા હતા તે તેમનામાં જાણે કે સંયોજિત થઈને પ્રગટ્યા હતા. તેમાંના થોડાં ઉદાહરણો પણ આ બાબતની સાહજિકતા દર્શાવી શકે.

પાળિયાદ વગેરે ગામ જેમને મળ્યા હતા તે ગોહિલકુળના મૂળપુરુષ સેજકજીના ભાઈ દેપાળને બળણને બદલે પોતાની સીને વાવણિયે જોડી વાવણી કરતા બેઠું ચારણે ટોણો મારતા સીને મુક્ત કરવા તેઓ જાતે વાવણિયે જુત્યા. જે બે ઓળ સુધી દેપાળએ વાવણિયે જોડાઈ ફર્યા હતા તેનો પાક આવતાં તાં જુવારની જગ્યાએ સાચા મોતી પાક્યાં હતા. આવા પ્રજાપત્સલ ગોહિલો ગંગાજળિયા કહેવાયા હતા.

સેજકજીના મોટા પુત્ર રાણજીએ કેટલોક પ્રદેશ જીતી લઈ રાણપુર વસાયું અને મુસ્લિમ સૈન્ય સામે લડતા વીરગતિ પામ્યા. તેમણે બંધાવેલો કિલ્લો આજે પણ ઊભો છે, જ્યાં ગુજરાતનો એક માત્ર જૌહરકૂવો છે. પૌત્ર વીર મોખદાજીએ ઘોધામાં રાજગાડી કરી, દરિયાબેઠુંઓને રક્ષણ અને હુંક આપ્યાં, દરિયાપીર કહેવાયા, પીરમના પાદશાહ તરીકે નામના કાઢી. સુરતમાં ઘોધારાણાના નામે તેમનું મંદિર છે. મુસ્લિમ ફોજ સામે લડતાં તેમનું મસ્તક ઘોધામાં પડ્યું અને ધડ લડતું લડતું ૨૧ કિલોમીટર દૂર ખડદપર જઈને પડ્યું. યુવરાજ વખતસિંહજી ‘આતાભાઈ’ પાસે રડતા હરિજને ફરિયાદ કરી. તેની દીકરીને હરામખોરો ઉપાડી ગયા હતા. ‘તારા ધણી બાપુ છે, રો મા’ કહીને કાચી ઉમરના યુવરાજ વગર પલાણે ઘોડીએ ચંડા, મોટી સંખ્યાના હરામખોરોને પડકાર્યા, મારી હઠાવ્યા અને હરિજનબાળાને સુરક્ષિત રીતે માવતરને સોંપીને જ જંધ્યા. રાજીવી તરીકે પરાકમી વખતસિંહજીએ અનેક યુદ્ધો ખેલી ઉ તાલુકા જેવડા ભાવનગર રાજ્યને ૧૦ તાલુકા જેવું પ્રથમ કશ્યાનું, કાઠિયાવાડનું ત્રીજા કમનું, રાજ્ય બનાવ્યું. તેમના દાદા ભાવસિંહજી (પહેલા)એ સન ૧૯૨૭માં અક્ષયતૃતીયા (વેશાખ સુદ - ૩) ગુરુવારે સં. ૧૯૭૮ના શુભ દિને ભાવનગરની સ્થાપના કરી નવો ઈતિહાસ રચ્યો. બંદર પણ સ્થાપ્યું અને ભાવનગર રાજ્ય સંસ્કાર અને સમૃદ્ધિમાં આગળ આવ્યું.

રાજ્યવહીવટમાં જેમણે માણસાઈના મૂલ્યોને શિરસ્થાને ગણ્યા છે તેવા રાજીવીઓમાં દાકોર વજેસિંહજી મહારાજાને ગણી શકાય. ભાવનગર રાજ્ય સામે પડેલા બહારવટિયા જોગીદાસ ખુમાણના સ્વી-બાળકોને તેમણે આદરભાવ સાથે પોતાના રાજ્યમેહલમાં કુંભ્યોજનોની જેમ સાચવ્યા હતા, જોગીદાસના પિતાનું શાદ્દ પોતે જ પુત્રમાવે કર્યું હતું. ઉમદા ખાનદાનીના આવા ઉદાહરણો શોધા પણ ન જરૂરી.

સેજકજીથી આરંભીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી સુધીના ૭૦૦ વર્ષોમાં ૨૬ રાજીવીઓ થઈ ગયા. તેમાંથી કોઈ એક પણ પ્રજાપીડક ન હતા.

તેઓ સૌ એક-એકથી ચિદિયાતા પ્રજાવત્સલતાના ઉદાહરણો દર્શન કરી મેં સત્સંગ કરેલા છે. મને એ વસ્તુ ગમે છે. મહારાજાને જેમ સંતો પ્રત્યે પ્રેમભાવ હતો તે ભાવનગર રાજ્યના પૂર્વ રાજીવીઓ પણ સંતો પ્રત્યે પુજ્યભાવ રાખતા હતા. ઠાકોર વજેસિંહજી બાપુએ ભગવાન શ્રીહંરિની ભાવનગરમાં પદ્ધરામણી કરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. જે ગાથાને આપણે ડિસેમ્બર-૨૦૧૫ના ચિંતન અંકમાં માણી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ તા. ૧૮-૫-૧૮૧૨ના રોજ મહારાણી નંદકુરબાના કૂઝે થયો હતો. મહારાજાએ પોતાના પિતા ભાવસિંહજીના મૃત્યુ બાદ ઈ.સ. ૧૮૧૮માં ભાવનગરની ગાઢી સંભાળી ત્યારે તેમની ઉમર ફક્ત ૭ વર્ષની હતી. બાર વર્ષની ઉમરે ભાવનગર આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની મુલાકાત યોજાઈ. જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા. દીર્ઘદીથા રાજ્યનીતિજ્ઞ અને વિચારકા બૌદ્ધિક સર પ્રભાશંકર પદ્ધતીના સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. ઈ.સ. ૧૮૧૩માં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના લગ્ન જેમનો જન્મ સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ થયો હતો એવા ગોડલના મહારાજા શ્રી ભગવતસિંહજીના પૌત્રી વિજ્યાકુરવબા સાથે થયા. વિજ્યાબાના ધાર્મિક, પ્રેમણ, સરળ અને ઉમદા સ્વભાવે પણ તેમના જીવનમાં પ્રભાવક રંગો પૂર્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ જે રાજ્યને રામારજ્ય કહીને જેની ખાનદાનીનું યોગ્ય સત્કાર-સન્માન કરીને અને એ ખાનદાની વંશ પરંપરાગત રહેશે એવા આશીર્વાદ સાથે નવાજ્યા છે એવા ભાવનગર ગોહિલવાડ રાજ્યના છેલ્લા રાજીવી પ્રજાવત્સલ, ન્યાયપ્રિય ગોહિલકુળના દસમાં વંશજ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના વિશેષ પ્રેરણાદાયી પ્રસંગોને આપણે માણીશું. (નોંધ: અહીં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જે પ્રસંગો આલેખવામાં આવ્યા છે તે, તેઓના જીવન કમ એટલે સાલ પ્રમાણે નથી.)

■■■ ગાંધીજી અને મહારાજા

સૌરાષ્ટ્રના ૨૨૨ રજવાડાઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજને ઈતિહાસના પરિવર્તનનોને પારખનારા રાજીવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજીવોનો પ્રશ્ન હજુ ઉકેલાયો નહોતો. કેટલાયે રાજીવીઓ સ્વતંત્ર બની જતા ટકાવી રાખવાના સપના સેવી રહ્યા હતા. કાયદે આજમ જીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજીવીઓને લલચાવી રહ્યા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજીવીઓના જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તત્ત્વ આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનતરાય પદ્ધતી હાજર નહોતો. બળવંતરાય મહેતા પણ

મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જેમ પૂર્વજોએ સ્થાપેલી સંસ્કારપરંપરાનો લાભ મળ્યો હતો તેમ ભાવેણાની ભૂમિએ પણ તેમને ઘણું આંતર પ્રદાન કર્યું હતું. કેમ કે સંસ્કૃતિ કે વ્યક્તિના ઘડતરમાં ભૂમિનો પ્રભાવ હોય છે. વ્યક્તિ, સમાજ અને વાતાવરણના વિકાસમાં ભૂમિનું સત્ત્વ અનેક રીતે પ્રગતાં હોય છે. ભાવનગર ક્ષેત્રની સંસ્કારિતા એ રીતે જીવંત છે. મહાત્મા ગાંધીજીએ જે ભૂમિમાં રહીને થોડા માસ ઉચ્ચ શિક્ષણ લીધેલું તેનું ગૌરવ તેમણે જીવનભર શિરોધાર્ય ગણ્યું હતું. આ ભૂમિના રાજાને દેશની અંહિતતાના હિતાર્થે ક્ષણભરમાં ગાદીત્યાગ કરવાનું સૂઝ્યું તેમાં પણ ભૂમિનું જ તેજ ગણ્યું રહ્યું.

આ ભાવનગર ભૂમિનો મહિમા દર્શાવવા પ્રસિદ્ધ કેળવણીકાર શ્રી નાનાભાઈ ભડુ પોતાના ‘ઘડતર અને ચડતર’ નામના પુસ્તકમાં લખે છે: “ભાવનગરની ઘરતીમાં એવું કંઈક પડ્યું છે કે લોકો ઈચ્છે કે ન ઈચ્છે, અમલદારો ઈચ્છે કે ન ઈચ્છે, પણ માણસાઈ પોતાનો માર્ગ કરે છે એ અને માણસાઈનો આવો કોઈક અંશ ભાવનગરની પ્રજાને ટકાવી રાખે છે. ભાવનગરની અને કાઠિયાવાડની માણસાઈને કોણો પોથી છે તેનો વિચાર કરવો ઘટે.” મહારાજા કૃષ્ણકુમારસિંહજી આ ભાવભૂમિના ચેતનાસ્થાનોની ભરપૂર પ્રેરણા પામ્યા હતા. તે ભૂમિમાં તેઓ સતત ફરતા રહેલા, પ્રજાના સુખ-દુઃખ જીડીને પ્રજાવિકાસના કાર્યો કરતા રહેલા. તેમની સાથેના પણ અનેક સમરણો આ ભૂમિ સાથે જોડાયેલા રહ્યા છે. મહારાજા વિદેશમાં કે દૂરના હવાભાવાનાં સ્થળોએ ઉનાળા ગાળવાના બદલે આ ભૂમિના દરિયાકિનારાના સ્થળોએ વધુ નિવાસ કરતા તે તેમની ભૂમિ પ્રત્યેરી આમીયાતા દર્શાવે છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સાધુસંતોના સમાગમની ઊડી તમશા હતી. તેઓ તેને પોતાનું વ્યસન કહેતા. કોઈ નવા સ્થળે ગયા હોય તો પહોંચાતાવેંત પ્રશ્ન કરતા કે આ સ્થળે કોઈ દર્શનીય સાધુ-સંતો-મહાપુરુષો છે કે કેમ? જો એવા કોઈ સંતપુરુષની માહિતી મળે તો બીજા કામો છોરીને તેમને અનન્યભાવે મળી લેતા. તેઓ કહેતા પણ બરા કે ભાવનગર, સૌરાષ્ટ્ર, ગુજરાત કે દેશના પ્રાંતેપ્રાંતના બન્યા તેટલા સંતોના

દર્શન કરી મેં સત્સંગ કરેલા છે. મને એ વસ્તુ ગમે છે. મહારાજાને જેમ સંતો પ્રત્યે પ્રેમભાવ હતો તે ભાવનગર રાજ્યના પૂર્વ રાજીવીઓ પણ સંતો પ્રત્યે પુજ્યભાવ રાખતા હતા. ઠાકોર વજેસિંહજી બાપુએ ભગવાન શ્રીહંરિની ભાવનગરમાં પદ્ધરામણી કરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. જે ગાથાને આપણે ડિસેમ્બર-૨૦૧૫ના ચિંતન અંકમાં માણી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ તા. ૧૮-૫-૧૮૧૨ના રોજ મહારાણી નંદકુરબાના કૂઝે થયો હતો. મહારાજાએ પોતાના પિતા ભાવસિંહજીના મૃત્યુ બાદ ઈ.સ. ૧૮૧૮માં ભાવનગરની ગાઢી સંભાળી ત્યારે તેમની ઉમર

ફક્ત ૭ વર્ષની હતી. બાર વર્ષની ઉમરે ભાવનગર આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની મુલાકાત યોજાઈ. જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા. દીર્ઘદીથા રાજ્યનીતિજ્ઞ અને વિચારકા બૌદ્ધિક સર પ્રભાશંકર પદ્ધતીના સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. ઈ.સ. ૧૮૧૩માં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના લગ્ન જેમનો જન્મ સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ થયો હતો એવા ગોડલના મહારાજા શ્રી ભગવતસિંહજીના પૌત્રી વિજ્યાકુરવબા સાથે થયા. વિજ્યાબાના ધાર્મિક, પ્રેમણ, સરળ અને ઉમદા સ્વભાવે પણ તેમના જીવનમાં પ્રભાવક રંગો પૂર્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ જે રાજ્યને રામારજ્ય કહીને જેની ખાનદાનીનું યોગ્ય સત્કાર-સન્માન કરીને અને એ ખાનદાની વંશ પરંપરાગત રહેશે એવા આશીર્વાદ સાથે નવાજ્યા છે એવા ભાવનગર ગોહિલવાડ રાજ્યના છેલ્લા રાજીવી પ્રજાવત્સલ, ન્યાયપ્રિય ગોહિલકુળના દસમાં વંશજ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના વિશેષ પ્રેરણાદાયી પ્રસંગોને આપણે માણીશું. (નોંધ: અહીં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જે પ્રસંગો આલેખવામાં આવ્યા છે તે, તેઓના જીવન કમ એટલે સાલ પ્રમાણે નથી.)

સૌરાષ્ટ્રના ૨૨૨ રજવાડાઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજને ઈતિહાસના પરિવર્તનનોને પારખનારા રાજીવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજીવોનો પ્રશ્ન હજુ ઉકેલાયો નહોતો. કેટલાયે રાજીવીઓ સ્વતંત્ર બની જતા ટકાવી રાખવાના સપના સેવી રહ્યા હતા. કાયદે આજમ જીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજીવીઓને લલચાવી રહ્યા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજીવીઓના જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તત્ત્વ આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનતરાય પદ્ધતી હાજર નહોતો. બળવંતરાય મહેતા પણ

દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરને પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી ટેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જરૂર સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.

તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જરૂર ગાંધીજીને મળવું. તેમણે ગઠાથી શેઠ મોહનલાલ મોતીયંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જરૂર ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા ૧૭ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ રાતે ૧૧ વાગ્યે મળવા ગયા. મનુભહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી ભાગ-૧’ પુસ્તકમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન કર્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુભહેનને બહાર કાર સામે જરૂર મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. જ્યારે મહારાજા ગાંધીજીના ખંડમાં પ્રવેશયા ત્યારે ગાંધીજીના હાથમાં મધુ અને લીંબુ સાથેના પાણીનો ઘાલો હતો તે મનુભહેનના હાથમાં સોંપી તેઓ ઊભા થઈ ગયા. અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. દીવાન અનંતરાય પણ્ણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી. મહારાજાએ ગાંધીજીને નમતાપૂર્વક જણાવ્યું કે, મારું રાજ્ય હું આપના ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આશા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું : “આપના રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?” ત્યારે મહારાજાએ કહ્યું : “મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે.” પછી ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈપટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી દિલ્હી રોકાયા હતા અને સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાર્થકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજીવાઓને કહેતા કે તમે પૂછતા હતા ને કે અમારે હવે શી રીતે વર્તવું ? તો

તમે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છો. મનુભહેને પાછળથી ગાંધીજીને પૂછ્યેલું : “બાપુ ! આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ ? ” ત્યારે ગાંધીજીએ કહ્યું : “મનુ ! તું જાણો છો ના કે હું ભાવનગરની શામણાસ કોલેજમાં ભખ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.”

■ સમય પાલનતાના આગામી મહારાજા

મુંબઈના ગવર્નર સર જ્યોર્જ કલાર્ક ૧૯૦૭માં ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. શિષ્ટાચાર એવો હતો કે, વજમાન મહારાજા મહેમાનને ઉતારે ચોક્કસ સમયે પ્રથમ મુલાકાત માટે જાય. આ મુલાકાત દસ-પંદર મિનિટ પૂરી હોય. પછી વળતી મહેમાન વજમાનને ત્યાં જરૂર મુલાકાત આપે. કુમ મુજબ મહારાજા ગવર્નરની મુલાકાતે તેમને ઉતારે જરૂર આવેલા. પછીની મુલાકાત માટે ગવર્નર પોણા અગિયાર વાગે આવવાના હતા. છતાં દ્રાવેલા સમયે ગવર્નર આવ્યા નહીં. દસેક મિનિટ રાહ જોઈ મહારાજા પોતાની ગારીમાં બેસી નીકળી ગયા. નીલમબાગથી મોતીબાગ જતાં રસ્તામાં ગવર્નરની ગારી સામી મળી. મહારાજાએ ગારી થોભાવી વિવેકથી જણાવ્યું : ‘Your excellency, I waited for ten minutes, but I have got to attend my office, so, formalities of a return visit may be dispensed with.’ વાત ખરી હતી. મહારાજા દરરોજ સમયસર ઓફિસે હાજરી આપતા. પણ ગવર્નરને અપમાન લાગ્યું. એમ કહેવાય છે કે દીવાન પ્રભાશંકર પણ્ણીએ ગવર્નરને એ રીતે સમજાવી સમાધાન કર્યું કે સમય પ્રમાણે કામ કરવાની પદ્ધતિ અંગેજો પાસેથી અહીંની પ્રજામાં થોડા કેળવાયેલા લોકો શીખ્યા છે. એ યશ અંગેજોને છે. તેમાંય દેશી રાજ્યના રાજી જો આ રીતે કામ કરતા શીખ્યા હોય તો અંગેજ અધિકારીએ મગરૂર થયા જેવી વાત છે. જો કે ફરી મળતી વખતે વિનયથી પોતાનું દિનિંદુ સમજાવી હિલ જતવાની શક્તિ મહારાજ કૃષ્ણકુમારસિંહજીમાં હતી.

॥ શ્રી સ્વામિનારાયણ વિજયતાનામ ॥

પ.પુ. ધ.ধ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અન્નપ્રસાદજી મહારાજશ્રીના રૂડ આશીર્વાદ સહ આશાથી

નૂતન શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર - જગાન્નાથપુરી પટાંગણમાં પંચ દિનાત્મક સત્સંગ સેમારોછ તથા સમૂહ મહાપૂજા

તારીખ :- ૧૬ થી ૨૦-૩-૨૦૧૬

પ્રયોજક તથા વક્તા :- પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

સ્થળ :- નૂતન શ્રી સ્વા. મુખ્ય મંદિર, બાલાકુંડ, પુરી-કોણાક રોડ, જગાન્નાથપુરી, (ઓરીઝના)

વધુ માહિતી માટે સંપર્ક :- પૂ. પલિતપાણ સ્વામી - મો. ૭૬૦૦૫૮૫૦૫ રાજુભાઈ પટેલ - મો. ૦૮૪૩૭૦૭૧૧૧૪૦



સ્વામિનારાયણ વિજયતાનામ - જાન્યુઆરી - ૨૦૧૬



સત્સંગ સમાચાર પત્રિકા

સ્વામી ધનશ્યામદાસજી તથા શા. સ્વામી સર્વમંગલદાસજી તથા સાધુ ધર્મવલભદાસજી



દેશભક્ત મનુષ્યના
દેશલી



વડતાલ પ્રદેશના દેશલી (તા. માતર)ને આંગણો યોજાપેલ હોમાત્મક મહાપૂજામાં પધારી દર્શન-આશીર્વાદ પાડવતા પ.પુ. નાનાલાલજી મહારાજશ્રી.



નવ્ય શક્કોટેવ
જમકા



જૂનાગઢ પ્રદેશના જામકા (તા. ઉના)ને આંગણો યોજાપેલ ભવ્ય શક્કોત્સવમાં પધારતા પ.પુ. નાનાલાલજી મહારાજશ્રી.



કથાપારાયણ
ભાખા



જૂનાગઢ પ્રદેશના ભાખા (તા. વિસાવદર)ને આંગણો યોજાપેલ કથાપારાયણમાં પધારતા પ.પુ. નાનાલાલજી મહારાજશ્રી.

ભવ્ય શાકોત્સવ
વડોદરા



વડોદરાને આંગણે પ.પૂ. અ.સૌ. માતુશ્રી (ગાદીવાળા)ના જન્મોત્સવ પ્રસંગે પ.પૂ. લાલજી મહારાજશ્રીના ટિવ્ય સાત્રિધ્યમાં
યોજાયેલ ભવ્ય શાકોત્સવ, સત્સંગ સભા, રક્તદાન તથા સર્વરોગનિદાન કેમ્પ.



સરધારધામને આંગણે પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી યોજાયેલ ભવ્ય શાકોત્સવ પ્રસંગે કથાવાતારનો લાભ આપતા પૂ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

ભવ્ય શાકોત્સવ
લાલજી મહોદરા



ગઢા પ્રદેશના નાના ભમોદરાને આંગણે પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી યોજાયેલ ભવ્ય શાકોત્સવમાં કથાવાતારનો લાભ આપતા પૂ. સ્વામી.



ડોનીવલીને આંગણે નૂતન મંદિર શ્રીનિશીટી ખાતે મુંબઈ પરાવિસ્તારના યુવાનો દ્વારા યોજાયેલ 'શ્રી સ્વામિનારાયણ ખેલ મહોત્વાં'



ગઢા પ્રદેશના ધારેશ્વર (તા. રાજુલા)ને આંગણે યોજાયેલ ભવ્ય શાકોત્સવમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



જૂનાગઢ પ્રદેશના અગતરાય (તા. કેશોદ)ને આંગણે યોજાયેલ ભવ્ય શાકોત્સવમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



જૂનાગઢ પ્રદેશના વરાજાંગ જાળિયા (તા. ઉપલેટા)ને આંગણે યોજાયેલ ભવ્ય શાકોત્સવમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



રાજકોટને આંગણે પ.પુ. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી યોજાયેલ ધનુમાર્સ કથાપારાયણ પ્રસંગે પધારતા પ.પુ. નાનાલાલજ મહારાજશ્રી





જૂનાગઢ પ્રદેશના નાવડા (તા. માણાવદર)ને આંગણે યોજાયેલ ભવ્ય શાકોત્સવમાં તેમજ વેરાવળ (સોમનાથ)ને આંગણે યોજાયેલ કથાપારાયણમાં પધારતા પ.પુ. નાનાલાલજ મહારાજશ્રી.



દહિસર (મુંબઈ)ને આંગણે પ.પુ. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી સત્તંગ મંડળ દ્વારા યોજાયેલ ભવ્ય શાકોત્સવ તથા ત્રિદિનાત્મક સત્તંગ સમા



મીરારોડ (મુંબઈ)ને આંગણે પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી ધર્મકુળ આશ્રિત બૃહ્દ મુંબઈ પરવિસ્તાર દ્વારા યોજાતી 'દિમાસિક સત્સંગ સભા'માં પખારતા પ.પૂ. લાલજ મહારાજશ્રી.



પ.પૂ. આચાર્ય મહારાજશ્રી તથા પ.પૂ. લાલજ મહારાજશ્રીના આશીર્વાદથી
પુ. કો. સ્વામી શ્રી ધનશ્યામવલ્લભદાસજ્ઞના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલ ગઠપુરથી ભુજ સુધી પદ્યાત્રા



શિકાળો શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી પ.પૂ. લાલજી મહારાજશ્રીના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલ 'નિંટર શિબિર - ૨૦૧૫'નો લાભ લેતા અમેરિકાના અલગ-અલગ રાજ્યના યુવકો તથા યુવતીઓ.



સેકન્ડન શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી પ.પૂ. લાલજી મહારાજશ્રીના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલ 'નિંટર શિબિર - ૨૦૧૫'નો લાભ લેતા અમેરિકાના અલગ-અલગ રાજ્યના યુવકો તથા યુવતીઓ.

પ.પૂ. સનાતન ધ.ধુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અનેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાથી શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર દારા તથા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશમાં મુપ્રસીદ્ધ વક્તા પૂ. સ.ગુ. સ્વામી નિત્યસૃપદાસજીના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ

ગૂતન હરિમંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા તથા કથા મહોત્સવોની તિથિ-તારીખ

ક્રમ	કથા તારીખ	કથા તિથિ	પ્રતિષ્ઠા તિથિ	સ્થળ
૧.	૨૬-૧-૨૦૧૬ થી ૩૦-૧-૨૦૧૬	પોષ વદ - ૨ થી પોષ વદ - ૬	પ્રતિષ્ઠા મહોત્સવ પોષ વદ - ૬	મુ. શ્રી સ્વા. મંદિર - ધારી ગુંડાળી, તા. ભેંસાણ, જી. જીનાગઢ સંપર્ક :- મો. ૮૪૨૮૮૮૭૬૩૮૦
૨.	૬-૨-૨૦૧૬ થી ૧૫-૨-૨૦૧૬	મહા સુદ - ૧ થી મહા સુદ - ૮	પ્રતિષ્ઠા મહોત્સવ મહા સુદ - ૨	મુ. શ્રી સ્વા. મંદિર - રાણસીકી, તા. ગોડલ, જી. રાજકોટ સંપર્ક :- મો. ૮૮૨૪૫૫૬૦૧૫, ૮૮૭૮૦૧૬૮૮૨
૩.	૧૬-૨-૨૦૧૬ થી ૨૦-૨-૨૦૧૬	મહા સુદ - ૮ થી મહા સુદ - ૧૧	પ્રતિષ્ઠા મહોત્સવ મહા સુદ - ૧૧	મુ. શ્રી સ્વા. મંદિર - મેધલપુર, તા. સોજાના, જી. આણંદ સંપર્ક :- મો. ૮૮૨૪૧૩૪૧૦૮, ૮૭૧૪૨૭૫૮૭૭
૪.	૨૫-૨-૨૦૧૬ થી ૨-૩-૨૦૧૬	મહા વદ - ૩ થી મહા વદ - ૮	મંદિર પંચાંધી મહોત્સવ	મુ. શ્રી સ્વા. મંદિર - કાલોલ, જી. પંચમાલાલ સંપર્ક :- મો. ૮૮૨૪૧૩૪૧૦૮, ૮૩૭૬૧૭૭૫૮૮
૫.	૧-૩-૨૦૧૬ થી ૫-૩-૨૦૧૬	મહા વદ - ૭ થી મહા વદ - ૧૧	પ્રતિષ્ઠા મહોત્સવ મહા વદ - ૧૧	મુ. શ્રી સ્વા. મંદિર - અમલોડ, તા. જી. દાહોંદ સંપર્ક :- મો. ૮૮૨૪૧૩૪૧૦૮, ૮૭૩૭૨૪૮૭૭૨
૬.	૫-૩-૨૦૧૬ થી ૮-૩-૨૦૧૬	મહા વદ - ૧૧ થી મહા વદ - ૩૦	પ્રતિષ્ઠા મહોત્સવ મહા વદ - ૧૧	મુ. શ્રી સ્વા. મંદિર - ખરોડ, તા. લીમેડા, જી. દાહોંદ સંપર્ક :- મો. ૮૮૨૪૧૩૪૧૦૮, ૮૮૭૮૨૪૫૭૩૩
૭.	૧૧-૩-૨૦૧૬ થી ૧૫-૩-૨૦૧૬	ફાગણ સુદ - ૩ થી ફાગણ સુદ - ૭	પ્રતિષ્ઠા મહોત્સવ ફાગણ સુદ - ૩	મુ. શ્રી સ્વા. મંદિર - સર, તા. જી. રાજકોટ સંપર્ક :- મો. ૧૦૮૮૮૮૮૮૮૩
૮.	૧૧-૩-૨૦૧૬ થી ૧૫-૩-૨૦૧૬	ફાગણ સુદ - ૩ થી ફાગણ સુદ - ૭	પ્રતિષ્ઠા મહોત્સવ ફાગણ સુદ - ૩	મુ. શ્રી સ્વા. મંદિર - ઉમરાળી, તા. જસદાસ, જી. રાજકોટ સંપર્ક :- મો. ૧૦૮૮૮૮૮૮૮૩
૯.	૧૬-૩-૨૦૧૬ થી ૨૦-૩-૨૦૧૬	ફાગણ સુદ - ૮ થી ફાગણ સુદ - ૧૨	સત્સંગ સમારોહ સમૂહ મહાપૂજા	મુ. ગૂતન શ્રી સ્વા. મંદિર - જગન્નાથપુરી (ઓરિસસા) સંપર્ક :- મો. ૭૬૦૦૦૪૮૫૦૫, ૦૮૪૩૭૦૧૧૪૦
૧૦.	૨૮-૩-૨૦૧૬ થી ૫-૪-૨૦૧૬	ફાગણ વદ - ૫ થી ફાગણ વદ - ૧૩	જગન્નાથપુરી મહોત્સવ	મુ. 'હરિકૃષ્ણ ગ્રાઉન્ડ' શ્રી સ્વા. મંદિર-સીમાડા, સુરત સંપર્ક :- મો. ૮૦૮૮૮૮૮૮૮૨૧, ૮૦૦૦૦૪૮૫૦૩
૧૧.	૨૩-૪-૨૦૧૬ થી ૨૭-૪-૨૦૧૬	ચૈત્ર વદ - ૧ થી ચૈત્ર વદ - ૫	શ્રી સ્વામિનારાયણ બાળયુવા મહોત્સવ	મુ. શ્રી સ્વા. મંદિર - સરધાર, તા.જી. રાજકોટ સંપર્ક :- મો. ૭૬૦૦૦૪૮૫૦૫
૧૨.	૨૮-૪-૨૦૧૬ થી ૬-૫-૨૦૧૬	ચૈત્ર વદ - ૬ થી ચૈત્ર વદ - ૩૦	શ્રી સ્વામિનારાયણ મહોત્સવ	મુ. મોટા જીંગુડા, તા. સાવરકુડલા, જી. અમરેલી સંપર્ક :- મો. ૧૪૧૪૮૫૮૪૫૮
૧૩.	૭-૫-૨૦૧૬ થી ૧૩-૫-૨૦૧૬	વૈશાખ સુદ - ૧ થી વૈશાખ સુદ - ૭	પ્રથમ વાર્ષિક પાટોત્સવ	મુ. શ્રી સ્વા. મંદિર - પાદરીયા, તા. જી. ભરુચ સંપર્ક :- મો. ૮૮૨૪૮૮૮૦૨૨, ૮૪૨૪૮૨૭૧૦૦
૧૪.	૧૪-૫-૨૦૧૬ થી ૨૦-૫-૨૦૧૬	વૈશાખ સુદ - ૮ થી વૈશાખ સુદ - ૧૪	શ્રી સ્વામિનારાયણ મહોત્સવ	મુ. શ્રી કુંજબિહારી વાડી, માંગરોળ રોડ, કેશોદ. સંપર્ક :- મો. ૮૮૭૮૭૦૮૦૦૮
૧૫.	૧૫-૫-૨૦૧૬ થી ૨૧-૫-૨૦૧૬	વૈશાખ સુદ - ૮ થી વૈશાખ સુદ - ૧૫	વક્તા : પૂ. સ્વામી શ્રી પૂજાસ્વરૂપદાસજી	મુ. દેવનિકેતન આશ્રમ, લુપતવાલા, હંદિલાર (ઉત્તરાંધ્ર) સંપર્ક :- મો. ૦૮૨૨૨૭૫૦૫૨, ૮૩૨૪૨૪૮૫૩૨

:: તારીખ ::

૦૯-૦૨-૨૦૧૬

૬૨ મહિનાના પહેલા રવિવારે સરધારધામમાં યોજાતી

:: સમય ::

સવારે ૮ થી ૧

॥ અભયદાન માસિક સત્સંગ સભા ॥

સ્થળ :- શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર, તા.જી. રાજકોટ. ફો.નં. ૦૨૮૧ - ૨૭૮૧૨૧૧, મો. ૮૮૭૮૭૫૮૫૦૩

॥ श्री स्वामिनारायणो विष्णवतेतराम ॥

वडताल पीठाधिपति प.पू. ध.धु. १००८ श्री आचार्य श्री अजेन्द्रप्रसादजु महाराजश्रीना इडा आशीर्वां सह आळाथी

अयोध्या धामने आंगाए

प.पू. बागलालजु श्री अजेन्द्रप्रसादजु महाराजश्रीना तथा
प.पू. बागलालजु श्री दिव्याज्ञेन्द्रप्रसादजु महाराजश्रीना

यौवं संस्कार महोत्सव

तारीख :- २५-२-२०१६, महा वद - ३

समय
सारे ८:०० थी १:००



निमंत्रक :- श्रीहरि स्मृति सह समग्र धर्मकुण परिवार वती

प.पू. १०८ श्री भाविआचार्य श्री नृगेन्द्रप्रसादजु महाराजश्री तथा प.पू. नानालालजु श्री पृथ्वेन्द्रप्रसादजु महाराजश्री

आयोजक :- प.पू. बागलालजु यौवं संस्कार महोत्सव व्यवस्था समिति (वडताल प्रदेश)

शुभ स्थल श्री हनुमानगढ़ी, अयोध्या (उत्तरप्रदेश)

आसनोंध

जे हिंभक्तो धर्मकुण परिवारना आ पवित्र प्रसंगमां उपस्थित रहेवाना होय, तेओरो पोतानी विगतो नीये ज्ञावेल
संपर्क पर वहेली तके अवश्य नोंदावी देवी. जेथी आयोजक समितिने आप सर्व माटे व्यवस्था करवामा सानुकूणता रहे.



संपर्क :- पू. धनश्याम स्वामी - भो. ८८२५१३४१०८ पू. सर्वभंगल स्वामी - भो. ८४२७८५४०८०, ८०००२८४५३३

पदारो योगीयोक

॥ श्री स्वामिनारायणो विष्णवतेतराम ॥

वडताल पीठाधिपति प.पू. ध.धु. १००८ श्री आचार्य श्री अजेन्द्रप्रसादजु महाराजश्रीना इडा आशीर्वां सह आळाथी

पदारो सिमाडा

श्री स्वामिनारायण मुख्य मंटिर - जगाक्षाथपुरी आयोजित

जगन्नाथपुरी^{ମୁଖ୍ୟ} महोत्सव

सुरत 2016
अंतर्गत



सर्ववितारी भगवान श्री रुदामिनारायण

श्रीमद् भागवत कथा पारायण

॥ कथा समय ॥

सांझे - ०३:०० थी ०६:००
रात्रे - ०८:३० थी ११:३०

पूर्णाहुति

ता. ०५ - ४-२०१६

प.पू. ५.पू. १०८ श्री आचार्य
श्री अजेन्द्रप्रसादजु महाराजश्री

श्री जगन्नाथजु भगवान



प.पू. १०८ श्री भाविआचार्य
श्री नृगेन्द्रप्रसादजु महाराजश्री

वक्ता :- पू. स.गु. स्वामी श्री लित्यस्वरूपदासजु

नोंद :- संहितापाठ (पोथी पारायण) मां लाभ लेवा संपर्क करो.

मो. ९०९९९९९६६२१, ८००००५८०३

हमारा
लक्ष्य
विक्रम का कल्पणा है...

शुभेच्छक :
KHANTIL.com
World's Best Ethnic Store

स्थल : हरिकृष्ण ग्राउन्ड, श्री स्वा. मंटिर योगीयोक-सिमाडानी भाजुमां, राधेपार्क रोड, सुरत.



स्वामिनारायण चिंतन • जन्मुआरी - २०१६



તીર્થધામ ગઢાને આંગણે પ.પૂ. ધ.ধુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાથી, પ.પૂ. અ.સૌ ગાદીવાળા (માતૃશી)ના જન્મોત્સવના ઉપલક્ષમાં
દક્ષિણ વિલાગ ભાડીલા સત્સંગ સમાજ દ્વારા ઉજવાપેલ 'માતૃવંદના મહોત્સવ તથા ભવ્ય શાકોત્સવ' (તા. ૨૦-૧૨-૨૦૧૫)



સિમાડા-સુરત શહેરને આંગણે પ.પૂ. ધ.ধુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાથી, શ્રી સ્વામિનારાયણ મંદિર યોગીયોક-સિમાડા સત્સંગ
સમાજ દ્વારા ઉજવાપેલ 'ભવ્ય શાકોત્સવ'માં સત્સંગ-કથાવાર્તાનો લાભ આપતા પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી. (તા. ૩-૧-૨૦૧૬)



તीર्थयाम लोળ (વડताळ)ने आंगणे प.पू. ५.मु. आर्यो महाराजश्रीना दुडा आशीर्वाद सહ आशाथी प.पू. १०८ श्री बाविआर्य श्री गोद्ध्रप्राद्यु महाराजश्री तथा समग्र धर्मकुल पठिवाना
दिव्य सातिधर्म उज्ज्वलेव 'श्री स्वामिनारायण महोत्सव' तथा पू. म.गु. स्वामी श्री नित्यत्यर्थसरगुणा वडताळे 'श्रीभृं सतांगिगुरुन कथा पारायाण' (ता. ३ वी ८-१-२०१६)

१. प.पू. लालच्छ महाराजश्रीना राज्यो प्राम करता आयोजक पू. धनशयाम स्वामी, पू. सर्वभंगल स्वामी तथा पू. धर्मवल्लभ स्वामी. २. प.पू.
लालच्छ महाराजश्रीनु पुष्पाहर पहेशवीने स्वागत करता वडताळना अश्रगङ्ग भक्तो. ३. जोणना युवानो द्वारा स्वागत. ४. समग्र महोत्सवना
मुख्य यज्ञमानश्री विशालभाई पटेल (अभेरिका). ५. आयोजक समिति. ह थी १०. उत्साही सत्संग मंडणो. ११. सभामां उपस्थित पू. बचुबा
तथा पू. लालीराजा वगेरे धर्मदुर्ग परिवार. १२. कथानो लाभ देता चरोवर विस्तार भक्तजनो.



નીર્થધામ જોજ (વડતાલ)ને આગંકે ૫.૫૦, ૬.૪૦, આચાર્વ મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાથી ૫. પૂ. ૧૦૮ શ્રી ભાવિણાયાર્ચ શ્રી કૃગોલપ્રસાદજી મહારાજશ્રી તથા સમગ્ર ધર્મકુળ પરિવારના દિવ્ય સાનિધ્યમાં ઉજવાયેલ 'શ્રી ત્યામિનારાયણ મહોત્સવ' તથા ૫૦. સ.ગુ. સ્થાપી શ્રી નિનયાયપ્રદાસજુના વડતાલે 'શ્રીમદ્ સત્સંગિલુલ કદ્યા પારાયા' (તા. ઉ.બી. ૮-૧-૨૦૧૬)

૧. મનમોહક સભામંચ.
૨. શ્રી ધનશ્યામ પ્રાગટોત્સવમાં બંને પૂ. બાળલાલજીશ્રી.
૩. કથા અંતર્ગત જેતપુર ગાઢિ-પણ્ઠાભિપેક પ્રસર્ગે ઠાકોરજીનો અભિપેક કરતા ૫.૫૦. નાનાલાલજી મહારાજશ્રી.
૪. કથા અંતર્ગત અશ્વકૂટોત્સવની આરતી ઉત્તારતા ૫.૫૦. નાનાલાલજી મહારાજશ્રી તથા યજમાનશ્રી.
- ૫-૬-૭. ૫.૫૦. લાલજી મહારાજશ્રીની ભવ્ય સ્વાગત થોંભાયાગ્રા.
૮. સભામાં પધારતા ૫.૫૦. લાલજી મહારાજશ્રીને આવકારતા જોણ તથા વડતાલ ચરોત્તર વિસ્તારના ભક્તો.
૯. સાંસ્કૃતિક કાર્યક્રમ.
૧૦. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધર્મકુળ પરિવાર તથા હરિભક્ત સમુદ્ઘા.



સર્વાંગતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્યભૂમિ છોપ્યામાં પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સમગ્ર ધર્મકુળ પરિવારના સાનિધ્યમાં પૂ. સ.ગુ. સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજીના માર્ગદર્શન પ્રમાણે ઉજવાયેલ 'શ્રી છોપ્યાધામ મહોત્સવ'

૧-૨-૩. શ્રી છોપ્યાધામ મહોત્સવ પ્રસંગે પ.પૂ. લાલજી મહારાજશ્રીની ભવ્ય શોભાયાત્રા. ૪-૫. શ્રી નારાયણ સરોવરની સમૃહ આરતી ઉત્તારતા બંને પ.પૂ. લાલજી મહારાજશ્રી તથા સંતો-દરિબક્તો. ૬. પ્રાગટ્યસ્થાનમાં બાળપ્રભુ શ્રી ધનશ્યામ મહારાજ સમક્ષ ધરાવેલ છયનભૌણ અસ્કૂટ. ૭. બાળપ્રભુ શ્રી ધનશ્યામ મહારાજ પ્રાગટ્યભૂમિમાં બાળપ્રભુશ્રીની જ પરંપરાને જીવંત રાખવાનો શુભારંભ કરતા પ.પૂ. બાળશાલજી શ્રી યજેન્દ્રપ્રસાદજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી.